

દ્વિજણા દોષો અને રોગોથી બચવા માટેની જ્યણા ટીપ્સ

- (૧) ગેસ વગેરે પેટાવતા પહેલા પુંજાળીથી બરાબર પુંજી લો.
- (૨) સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી ચૂલો (ગેસ) કરવો નહિં.
- (૩) પ્રાણીજ દ્વિજોમાંથી બનેલા સાબુ-ટૂથપેસ્ટ, ખાદ્યપદાર્થો, દવાઓ વાપરવા નહિં.
- (૪) પર્વ તિથિઓમાં તથા પર્યુષણ-ઓળી વગેરેમાં લીલોતરી વાપરવી નહિં.
- (૫) પર્વ તિથિ અને દ અદ્ભૂતાઈઓમાં અનાજ દળવું કે દળાવવું નહિં (ત્રણ ચૌમાસી-પર્યુષણ-બે ઓળી)
- (૬) રસોડા તથા ઘરની દીવાલો-કબાટો બે ત્રણ દિવસે સાફ કરવા, જેથી જીવોની ઉત્પત્તિ ન થાય.
- (૭) રસોડામાં-કબાટમાં કે પેપર કે કાગળ ન મુકવા જેથી જ્ઞાનની આશાતના ના થાય.
- (૮) પાણી દરરોજ ગાળવું જોઈએ. એકના એક માટલાંને ફરી ગાળીને ન ભરાય બે માટલાં રાખવા, જેનો એકાંતરે ઉપયોગ થઈ શકે. (રોજ એક માટલું ભીનું રહેવાથી લીલ કુગની શક્યતા રહે)
- (૯) રસોડામાં ગેસ ઉપર લાઈટ ન રાખો. લાઈટની આસપાસ ઉડતી જીવાત તપેલીમાં કે વાસણમાં પડે તો મરી જય છે. સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં જ રસોડું કરો.
- (૧૦) રાઈ-મરચાં-ધાણાજૂરૂ તથા અન્ય મસાલામાં તે જ વર્ણની (રંગની) ઝીણી જીવાત થવાની સંભાવના છે. સાફ કરીને બરણીમાં ભરો અને ઉપયોગ કરતા પહેલાં પણ ખૂબ બારીકાઈથી જોઈ લો.
- (૧૧) પાણી વાપર્યા પછી જ્વાસ લૂધીને મૂકો. જ્વાસ માટલામાં સીધો ન બોળો. કપથી પાણી લેવું ફીજનું પાણી વપરાય નહીં અને તેના પાણીના બાટલા સીધા મોઢે ન લગાડો. (અંદા પાણીવાળા જ્વાસમાં સંમૂર્ચિદ્ધ જીવોની ઉત્પત્તિ થાય છે.)
- (૧૨) ચાની ભૂકી ચાળીને વાપરવી-ચોમાસામાં બેજવાળા વાતાવરણમાં એ જ વર્ણની ઝીણી જીવાત થવાની ધણી સંભાવના છે.
- (૧૩) શહેરોમાં કેરીનો રસ ધરે કાઢવાની પ્રથા ઓછી હોય છે. તૈયાર રસ લાવી તેને મગની દાળ સાથે વાપરો તો રસ વાસી પણ હોય, તેમાં કાચું દૂધ ભેગવેલું હોય તો દૂવીદળ

પણ થાય, ખમણું પણ સાથે ખાવાથી દૂવીટળ થાય. ધરે રસ કાઢો તો પણ તેની અંદર કાચું દૂધ ભેગવવું નહિં.

(૧૪) ધણા ચાની ભૂકી ઉકાળીને કાવો (જ્લેક-ટી) બનાવે છે. અને તેમાં જરૂર પૂરતું દૂધ નાંખીને ચા પીવે છે. આ ઉપરથી નાંખેલું દૂધ જો કાચું હોય તો તે ચા સાથે સેવ-ગાંઠીયા-ફાફડા વગેરે કઠોળના લોટમાંથી બનાવેલી કોઈપણ વાનગી ખાઈ શકાય નહિં.
(મગના ખાખરા-વડા વગેરે)

(૧૫) સુકવેલી ગવાર, મેથી, વાલોર, વગેરેમાં ધણી જીવાત થઈ જાય છે, તેથી ચોમાસામાં સૂકવણીના શાક બિલકુલ ન વાપરવા તથા અન્ય ઋતુમાં બરાબર તપાસ્યા પછી એનો ચાળીને ઉપયોગ કરવો.

(૧૬) લોટના ડબામાં ભરેલો લોટ જો કાળ થયા પહેલાં તે ડબાને તથા ચારણીને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ. જો ન કરવામાં આવે તો નવો લોટ પણ અભક્ષ્ય બને.

(૧૭) દિવસે વાપરેલ પાણી કે રસોઈના વાસણો મંજાઈ કે ધોવાઈ ગયા પછી કોરા કપડાંથી લૂછી યોગ્ય ઠેકાણે ઊંધા મૂકી દેવા જોઈએ. તથા બીજે દિવસે ઉપયોગ કરતા પહેલાં પૂંજને લૂછીને લેવા જોઈએ.

(૧૮) મેથી વગેરે ભાજુમાં નીચેના બે-ત્રણ પાંદા અત્યંત કોમળ હોય છે, તે અનંતકાય ગણાય માટે છોડી દેવા.

(૧૯) કાજુ અને અખરોટના બે ફાડિયા વચ્ચેના પોલાણમાં ઈયળ હોવાની સંભાવના છે, તેથી ફાડિયા કર્યા વિનાના આખા કાજુ વાપરવા નહિં. કાજુ તળતાં પહેલાં પણ આ કાળજ લેવી હિતાવહ છે.

(૨૦) અનાજ-લોટ વગેરે ચાળવા. અલગ અલગ ચારણા-ચારણી ધરમાં હોવા જોઈએ.

૧. ધઉનો ચારણો - ધઉ, પૌઅા, મમરા, દાળીયા, શીંગ, આખી સૂંઠ, મોટા કઠોળ વગેરે ચાળવા.

૨. ચોખાનો ચારણો - મગ, ચોખા, જરૂર, મેથી વગેરે નાના દાણાં માટે.

૩. લોટનો ચારણો - મસાલાના પાવડર તથા લોટ ચાળી શકાય.

૪. મેંદાનો ચારણો - આમચૂર વગેરે બારીક મસાલા તથા મેંદો વગેરે ચાળવા માટે.

- (૨૧) ચણાનો લોટ ચાળવાની ચારણી અલગ રાખવી તે જ ચારણીથી જો ઘઉંનો લોટ ચાળવામાં આવે તો તે ઘઉંના લોટની રોટી-પુરી, કાચા દૂધ, દહી, છાશ કે શ્રીખંડ સાથે ખાવાથી દ્રિવદળ થાય. એ જ રીતે ઘંટી-ઘરઘંટીની બાબતમાં પણ સમજવું.
- (૨૨) આજનો ચાળેલો લોટ આજે જ વાપરવો, બીજે દિવસે ફરીથી ચાળવો.
- (૨૩) કઢી બનાવતાં દહીનું છાશને બરાબર ઉકાળી પછી જ બેસન (ચણાનો લોટ) ભેળવો.
- (૨૪) દહીંવડા કે મઠુંડો જેવી વાનગીમાં પણ દહીં, છાશ, બરાબર ઉકાળી વાપરવામાં વિવેક રાખો.
- (૨૫) કાચા દહીની તપેલીમાં કુકરમાં મૂકીને સીટી બોલાવો તો દહીં બરાબર ઉકળ્યું હોય અને અંદરથી જરા પણ કાચું ન હોય એ જ ખપે. દહીં ખદ-ખદ થાય તેટલું ગરમ થવું જોઈએ.
- (૨૬) દૂધ અને તેલની બનાવટો, દૂધ અને ગોળની બનાવટો વિરૂદ્ધ આહાર બને છે માટે તેનો ઉપયોગ ટાળો.
- (૨૭) દૂધની સાથે ખટાશવાળા ફળો, કુટ સલાડ વાપરવાનું ટાળો.
- (૨૮) પીપરમીટ, ગોળીઓ, ચોકલેટ કે ટોફ્ફીઓ મોટે ભાગે અભક્ષ્ય હોય તેનો ઉપયોગ ટાળો. દેરાસરમાં ચઢાવાય નહિં.
- (૨૯) સામુદ્યાધિક ભોજન સમારંભમાં જ્યાણાં ૦૦:- શાક સમારવાવાળાને જેટલા બગડેલા શાક શોધે તેના દીઠ રૂ.૫ આપવાથી પ્રોત્સાહન આપવાથી જ્યાણાં પળાય છે. વટાણા ફોલવાથી જેટલા કીડા નીકળે તેટલા રૂપિયાનું પ્રોત્સાહન આપવું, જેથી જ્યાણાં પળાય અને શુદ્ધ ભોજન પણ થાય.
- (૩૦) બહારના પાઉં-બિસ્કિટ વગેરે બેકરી પ્રોડક્ટ અભક્ષ્ય હોય છે, વાપરવા નહિં. જૈન કેક જેવા નામથી વેચાતી આઈટમો પણ ન વાપરવી.
- (૩૧) ધણા દોષોથી અને રોગોથી બચવા માટે મીઠાઈ-ફરસાળા, તૈયાર લોટ વગેરે બહારનું વાપરવું નહિં.
- (૩૨) હોટલની વાનગીઓ અભક્ષ્ય અને જીવરક્ષાની સમજ વિના બનાવેલી હોય છે, માટે હોટલમાં જવું નહિં.
- (૩૩) આદ્રા નક્ષત્ર પછી તો કેરીનો રસ ન જ વપરાય. તે પહેલાં પણ વરસાદ થઈ ગયો હોય તો કેરીમાં જીવાત પડવાની સંભાવના છે. વરસાદ થયા પછી કેરીનો ત્યાગ કરો.

બજરનો કેરીનો રસ ન વાપરો. ઉતરી ગયેલી અને વાર્ણાતર થયેલી કેરીનો ઉપયોગ ન કરો.

(૩૪) વાસી માવાની વસ્તુ ન વપરાય. તાજો માવો પણ ધીમાં બરાબર શેકી પાકો કરેલો ન હોય તો બીજા દિવસે તે વાસી બને છે. સૂર્યોદય પૂર્વે કે સૂર્યાસ્ત બાદ માવો ન બનાવો.

(૩૫) બહારના તૈયાર બેસન-રવા-મેંદામાં પુષ્કળ જીવાત હોવાની સંભાવના છે. તે વાપરવા નહિં. ગાંઠિયા, ફાફડા માટે પણ તૈયાર બેસન વાપરવા યોગ્ય નથી.

(૩૬) મધ્ય, માખણ અભક્ષ્ય છે. તેના ભક્ષણ સાથે પુષ્કળ વિકલેન્દ્રિય જીવોનું ભક્ષણ થાય છે, માટે તેનો ત્યાગ કરવો.

(૩૭) કોકળા, ઈડલી, જલેબી વગેરેનો આથો રાત્રે ન પલાળવો.

(૩૮) આખા ગંઠોડા કે સૂંઠમાં પુષ્કળ જીવાતની સંભાવના છે. તેથી તૈયાર ગંઠોડાનો કે સૂંઠનો પાવડર વાપરવો નહિં. તેમાં પુષ્કળ જીવાત કુટાયેલી હોવાનો સંભવ છે. આખા ગંઠોડા કે સૂંઠ લાવી, ખૂબ જ જયણાપૂર્વક જોઈને ઘરે કુટવાથી મોટી જીવ વિરાધનાથી બચી જવાય છે. એ જ રીતે ત્રિકળા વગેરે દરેક બાબતમાં પણ સમજ લેવું.

(૩૯) બિસલેરી વગેરેના પાણી પીવા નહીં અને લગ્નાદિ પ્રસંગે પીવડાવવા નહિં. કારણ, તેમાં વાસી અને અળગાણ પાણીને કારણે અસંખ્ય જીવોની વિરાધના થાય છે.

(૪૦) પૌઆ, મમરા, ધાણી આદિમાં પુષ્કળ જીવાત થઈ જવાની સંભાવના છે. તેથી તેની વાપરતા-રાંધતા પહેલા ચાળણીથી બરાબર ચાળી લેવા, અને બારીકાઈથી તપાસી લેવા.

(૪૧) છુંદો, મુરબ્બો પાકી ચાસણીમાં કરેલો હોવો જોઈએ. અવસરે-અવસરે એનું નિરીક્ષણ કરો.

(૪૨) ચોમાસામાં તે દિવસે ફ્રોઝેલી બદામ મીઠાઈ પર ભભરાવવી હોય તો મીઠાઈ ઉપર ભભરાવાય નહિં. ચોમાસામાં આજની ફ્રોઝેલી બદામ મીઠાઈ પર ભભરાવી હોય તો મીઠાઈ બીજા દિવસે અભક્ષ્ય બને, પરંતુ ફ્રોઝેલી બદામ એ જ દિવસે ધીમાં શેકેલી હોય અથવા મીઠાઈમાં શેકાઈ ગઈ હોય તો બાદ નથી. મીઠાઈના કાળ પ્રમાણે ચાલે. યાદ રહે કે ચોમાસામાં ઓસાવેલી, તળેલી બદામ જ વપરાય, મામરો બદામ વપરાય નહિં.
(ચોમાસામાં તે જ દિવસે ફ્રોઝેલી બદામ ખપે છે.)

(૪૩) શાક સમારતાં વનસ્પતિમાં રહેલ જીવજંતુની હિંસા ન થાય તેની કાળજ લેવી. કોબીના પાંદડા ખોલી, તપાસી લેવા. ત્યાગ કરવો ઉત્તમ છે.

(૪૪) જમફળનાં બીજ એકદમ કડક હોવાથી ચૂલે ચડવા છતાં અચિત થતાં નથી માટે શાક સમારતી વખતે એમાંથી બી કાઢી નાંખવા યોગ્ય છે. જમફળમાં વિરાધના વધુ થાય છે તો છોડવા જોઈએ.

(૪૫) કાચું મીઠું સચિત હોવાથી સચિત ત્યાગીને ન વપરાય. આયંબિલમાં જે બલવણું વપરાય છે, તેને અચિત કરવાની પદ્ધતિ રાજ કુમારપાળથી માંડીને આજ સુધી સર્વત્ર સલામત રહી છે. નવા માટલામાં કાચું મીઠું ભરીને તે માટીના ટાંકણથી બંધ કરી દેવામાં આવે પછી જ્યારે કુંભાર ઈંટનો નિભાડો પકાવે ત્યારે નિભાડાની વચ્ચમાં માટલું ગોઠવી દેવામાં આવે. નિભાડાની આગમાં ઈંટો સાથે મીઠું પણ પાકી જાય. આ રીતે અચિત થયેલું મીઠું બે ચાર વર્ષ કે તેથી વધારે સમય સુધી અચિત રહે છે. તાવડી પર શેકેલું કે પાણીમાં ઓગળી ચાસણી કરીને ચૂલા પર પકાવેલું મીઠું વર્ષાંત્રમાં સાત દિવસમાં, શિયાળામાં પંદર દિવસમાં અને ઉનાળામાં ત્રીસ દિવસમાં જ પાછું સચિત થઈ જાય છે.

(૪૬) શેરડીનો રસ કાઢ્યા પછી બે ઘડીએ અચિત થાય છે. અચિત થયા પછી બે પ્રહર બાદ અભક્ષ્ય થાય છે.

(૪૭) તરતનો દળોલો લોટ સચિત-અચિત મિશ્ર ગણાય છે. વધુમાં વધુ પાંચ દિવસ સુધી તે મિશ્ર રહે છે. દળાયા બાદ ચાળી લીધા પછી બે ઘડીએ અચિત થાય છે.

(૪૮) માખણ માટે યોગશાસ્ત્ર અને જૈન તત્ત્વાદર્શો અંતર્મુહૂર્ત પછી અભક્ષ્ય ગણાવેલ છે. જ્યારે અન્ય સ્થળે છાશમાંથી છૂટું પડતાંની સાથે જ અભક્ષ્ય ગણાવેલ છે. હાલ તો તરત જ અભક્ષ્ય ગણવાનો બ્યવહાર પ્રવર્તમાન છે.

(૪૯) ધરના રસોડે તેમજ લગ્નના માંડવે, સંધ જમણ સમયે જ્યાળાનો પૂરો ખ્યાલ રાખવો જોઈએ. આજે જમણવારોનું બધું જ કામ કેટરર્સ દ્વારા કરાવાય છે. એટલે એમાં પાર વિનાની હિંસા થાય છે. પાણી ગાળ્યા વિના વપરાય છે. શાકભાજ માણસો સમારે છે. એમાં કેટલાંય કીડાઓનો સંહાર થાય છે. લીલા શાકભાજમાં કીડા હોય. નોકરો દયા પાળતા નથી. ભીડા અને કીડા બધું સમારીને વધારી નાંબે છે. જહેર જમણવારોની રસોઈ જ્યારે વહેલી પરોછે રંધાતી હોય ત્યારે તમે જોવા જાઓ તો જમી ન શકો

એટલી ગંદ્દીથી ભરપૂર હોય છે. કેટર્સેવાળા રસ્તે રખડતા, નાચા-ધોવા વિનાના, બિખારી જેવા દેખાતા, રખું છોકરાંઓને કપડાં પહેરાવીને રસોડામાં કામે લગાડી હે છે. તે રખુંઓ બીડીઓ કુંકતા કુંકતા, વાતો કરતાં કરતાં થુંક ઉડાડતાં ઉડાડતા કામ કરે છે. વચ્ચે એકી પણ જઈ આવે છે. આવ્યા બાદ ગંદા પગે જ પૂરીનો લોટ ગુંદવા મંડી પડે છે.

(૫૦) મોસંબી, સંતરા, પાકી કેરી, પપૈયું, શક્કરટેટી આદિ એકદમ પાકા ફળો છાલ-બી જુદા કર્યા બાદ બે ઘડીએ અચિત ગણાય છે. એકદમ પાકું કેળું લુમથી છૂટું પડતાં જ અચિત ગણાય છે. પાકા ફળોના રસ બે ઘડી (૪૮ મિનિટ) બાદ અચિત ગણાય છે.

(૫૧) આજકાલ કાકડી, ટીંડોરા, આદિ શાકોને વધાર કરીને તરત જ ચૂલેથી નીચે ઉતારી દેવાય છે. તેથી લગભગ તે કાચાં અને સચિત રહી જતાં હોય છે. બરાબર ચુદ્યા વગરનાં આવાં કાચાં શાક સચિતત્વાળીને કલ્પે નહિ.

(૫૨) લીલી દ્રાક્ષ (બી રહિત) અચિત છે, એમ સમજીને કેટલાક લોકો તેને આખે આખી વાપરે છે. નાસિક પીપળગાંંવ જેવા સ્થળોમાં જ્યાં પુષ્કળ દ્રાક્ષ પાકે છે તેવા સ્થળોમાં ખેડૂતો પાસેથી જાળવા મળે છે કે તેમાં સૂક્ષ્મ તંતુ જેવું બીજ હોય છે. એટલે એને બી રહિત માની શકાય નહિ. આવી દ્રાક્ષ સચિતત્વાળીને ખપે નહિ. તેને અચિત કરવા માટે ઉપયોગવંત શ્રાવકો પાણીમાં બાઢી નાખે છે. અથવા બે ટુકડા કરી એમાંથી બંને ભાગ ઉપરથી બીજ ધ્યાનથી કાઢી નાખે છે. પ્રકાશ સામે એ ટુકડો ધરવાથી અંદર રહેલ બીજ ધાણું કરીને દેખાઈ જાય છે.

ત્યાજ્ય પદાર્થો

૧

૨

૩

૪

૫

૬

૪ સાંયોગિક	૪ મહાવિગાઈ	૩૨ અનંતકાય	૪ ફળો	૫ ટેટા	૪
તુચ્છ ચીજો					

અભક્ષ્ય

દ્વિવદળ	માંસ	શાક-દ	બહુભીજ	વડના	ટેટા
ચાલિતરસ	મદિરા	ઓપધ-પ.	વેગણુ	પીપળાના ટેટા	કરા
બોળ અથાગું	મધ	ભાજી-પ.	તુચ્છફળ	ખલ્કા પીપરના	ટેટા
રાત્રિ ભોજન	માખણ	જંગલી-દ	અજાણ્યા ફળ	કાળા ઉમરાના ટેટા	ઝેર
		વેલ-જ		ઉમસનાં ટેટાં	

ચાર સાંયોગિક અભક્ષ્ય ૦:

૧. દ્વિવદળ ત્યાગ

જેમાં બે દળ, બે વિભાગ હોય તેવા ધાનને દ્વિવદળ કહેવાય છે. અલબત્ત, જેની દાળ બને તે બધા દ્વિવદળ ગણાય. મગ, તુવેર, અડદ, ચાણા, મઠ, વાલ, તુવેર, ચોળા, વટાણા, મેથી, મસૂર, કળથી અને લોંગની દાળ. આ બધાનાં લીલાં પાન, લીલા દાણાં તેમજ તેના લોટ બધું જ દ્વિવદળ કહેવાય.

દ્વિવદળની વ્યાખ્યા ૦:- ૧. જે વૃક્ષના ફળરૂપે ન હોય, ૨. જેને પીલવાથી તેલ ન નીકળે, ૩. જેને ભરડવાથી દાળ બને., ૪. જેના બે ભાગ વચ્ચે પડ ન હોય.

ઉપરોક્ત ચારે ચાર લક્ષણો જેમાં ઘટતાં હોય તેને દ્વિવદળ જાણવું, અન્યથા નહિ. રાઈ, સરસવ, તલ અને મગફળીમાં તેલ નીકળે છે, માટે તે દ્વિવદળમાં ન ગણાય. સાંગરી ઝાડના ફળરૂપે આવે છે માટે એ દ્વિવદળ ન ગણાય.

સમજૂતી ૦:- ઉપરોક્ત વ્યાખ્યામાં બંધ બેસતાં તમામ કઠોળમાંથી બનતી કોઈ પણ વાનગી જો કાચા. ૧. દહીં, ૨. દૂધ, ૩. છાશને સાથે ભજે તો બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. પછી તેનું ભક્ષણ કરવાથી હિંસાનો દોષ લાગે છે. માટે કાચા ગોરસ સાથે ક્યારેય કઠોળ લેળવવું નહિ. જો દહીં, દૂધ, છાશને સારી રીતે ગરમ કરી દેવામાં આવે તો કઠોળ સાથે જમવામાં દોષ લાગવાનો સંભવ રહેતો નથી. એકલા કઠોળની બનાવેલી વાનગીઓ ખાવામાં કે માત્ર ગોરસ ખાવામાં દ્વિવદળનો કોઈ દોષ નથી, પણ બનેનું સંયોજન કરીને ખાવામાં જ હિંસાજન્ય દોષો લાગે છે. આવો સાંયોગિક દોષ પણ દ્વિવદળરૂપ બને છે.

જહેર રસ્તા પર પડેલા સૂક્ષ્મ છાણમાંથી જીવોત્પત્તિ હોતી નથી, પણ તેમાં વરસાદનું પાણી પડતાં જીવોત્પત્તિ થવા લાગે છે. આમ કેમ બન્યું ? છાણમાં જીવોત્પત્તિ માટે તેની સાથે જળનો સંયોગ અપેક્ષિત હતો. જો તેની સાથે જળનો સંયોગ ન થયો હોત તો તેમાં જીવ પેદા થાત જ નહિ. બસ ! આ જ રીતે કઠોળ સાથે માત્ર કાચા ગોરસ સંયોગની અપેક્ષા રહે છે. જો કાચા ગોરસનો સંયોગ ટાળી દેવાય તો જીવોત્પત્તિ થવાનો સંભવ રહેતો નથી અને હિંસાજન્ય દોપથી બચી જવાય છે.

❖ કઠોળ સાથે કાચા દહી, દૂધ, છાશનું મિશ્રણ થવાના પ્રસંગો (દ્વિવદળના દોષ)

1. દહીવડા ૦: હમણાં હમણાં ઘરમાં તથા જહેર પ્રસંગોમાં દહીવડા ખૂબ પિરસાય છે. વડા ચોળાની દાળમાંથી બનાવાય છે. પછી તેના ફીજમાંથી કાઢેલું આઈસિક્લેમ જેવું દહી પાથરવામાં આવે છે. આ દહી અને વડાનો સંયોગ થવા માત્રથી જ તેમાં તત્કાળ અસંખ્ય બેઈન્ટ્રિય જીવો પેદા થઈ જાય છે. તે જીવો અતિ સૂક્ષ્મ હોવાથી નજરે જોઈ શકતા નથી..

આંગળી દાજે તેવા ગરમ દહીનું વડાની સાથે મિશ્રણ કરવામાં આવે તો દોષ લાગતો નથી. ગરમ કર્યા બાદ જમતી વખતે તે ઠંડુ થઈ ગયું હોય તો ય કોઈ બાધ નથી, તેને ગરમ કરી દીધા પછી તેમાં જીવોત્પાદક શક્તિ રહેતી નથી. ઉત્પાદન શક્તિના અભાવે ઘઉં, બાજરી કે જુવારને શેકી નાખ્યા પછી વાવવાં છતાં તે ધાન્ય ઉંગાતું નથી.

2. રાયતું ૦:- દહીનું રાયતું અનેક રીતે બને છે. કાચા દહીમાં, ચાણાના લોટની બુંદી નંખાય છે. ત્યારે દ્વિવદળનો દોષ લાગે છે. કઠોળ સાથે ભેળવતાં પહેલાં દહીને સારી રીતે ગરમી કરી લીધું હોય તો દોષ નથી.
3. મેથીના થેપલાં ૦:- મેથી કઠોળ ગાળાય છે. તે જ રીતે મેથીની ભાજી પણ કઠોળ ગાળાય છે. આજકાલ બહેનો મેથીના થેપલાં બનાવતી વખતે દ્વિવદળની વાત સાવ જ ભૂલી જાય છે. થાળીમાં ઘઉં, બાજરીના લોટનો ચાળીને ઢગલો કરે છે, પછી તેમાં વચ્ચે ખાડો કરીને મેથીનાં પાંદડા નાંખે છે. પછી તે પાંદડા પર કાચી છાશ રેડી દે છે. આથી તેમાં અસંખ્ય બેઈન્ટ્રિય જીવોની ઉત્પત્તિ શરૂ થઈ જાય છે અને મસળાઈ જાય છે.
4. કઢી ૦:- જ્યારે છાશની કઢી કરવાની હોય ત્યારે બહેનો ચૂલ્હા પર તપેલીમાં છાશ નાંખીને તે ગરમ થયા પૂર્વે જ એમાં તે ચાણાનો લોટ ભેળવી દે છે. કાચી છાશમાં

ચણાનો લોટ ભળવાથી તેમાં તત્કાળ અસંખ્ય જીવો પેદા થાય છે. તે બધાં જીવો ઉકળતી કઢીમાં સ્વાહા થઈ જય છે. આ રીતે જીવોની ઉત્પત્તિ અને સંહાર એમ બંને દોષ લાગે છે, માટે છાશને સારી રીતે ગરમ કર્યા પછી જ તેમાં ચણાનો લોટ નાખવો જોઈએ. કઢી સાથે જો શ્રીખંડ વાપરવાનો હોય તો ચણાના લોટનું અટામણ ન નાખતાં ચોખાનો લોટ નાખવો જોઈએ. વધારમાં ભૂલેચૂકે પણ મેથીનો ઉપયોગ ન થાય તેનો ઝ્યાલ રાખવો જોઈએ, કેમ કે મેથી કઠોળ ગણ્યાય છે. શ્રીખંડના જમણવારમાં દોષથી બચવા શીંગદાળાનું શાક અને ચોખાના લોટના ખમણ બનાવવા જોઈએ, અને કઢીમાં પણ ચોખાનો લોટ નાંખવો જોઈએ. બધી સાવધાની રાખવા છતાં કઢીના વધારમાં ધ્યાન ન રાખ્યું તો હનુમાનના પૂંછદેથી આખો જમણવાર હિંસક બની જય છે. પાપભીરું પુણ્યાત્માઓએ ક્યારેય જમણવારમાં શ્રીખંડ સાથે ગોરસની વાનગીઓ બનાવવી જ નહિ.

૫. શ્રીખંડ ૦:- આજે લગ્ન સમારંભમાં શ્રીખંડનો મહિમા વધી રહ્યો છે. ઉનાળમાં લોકો શ્રીખંડનું જમણ પસંદ કરે છે. જમણમાં શ્રીખંડ આવે એટલે જોખમ ઘણું વધી જય છે. જમણમાં જો કોઈ પણ કઠોળની વાનગી હશે તો એ જમતાં થાળીમાં ભેગી થવાની દ્વિવદ્ધ થઈ જશે. શ્રીખંડની સાથેના જમણમાં લીલા-સૂકાં કઠોળના શાક, કેળાવડાં, ચણાનાં ખમણ, ખમણની ચટણી, મગની દાળ, પાપડ, ચણાના લોટવાળી અને મેથીના વધારવાળી કઢી આ કશું જ ચાલી શકે નહિ માટે શ્રીખંડનું જમણ જ ટાળવા યોગ્ય છે.
૬. ટોકળાં ૦:- ખાટાં ટોકળાં બનાવવા માટે કઠોળનો આટો છાશમાં પલાળવામાં આવે છે. આ આટો પલાળતાં પૂર્વે છાશને ગરમ કરેલી હોવી જોઈએ. છાશને ગરમ કર્યા વિના સીધો જ આટો પલાળવાથી દ્વિવદ્ધનો દોષ લાગે છે માટે કાળજી રાખવી જરૂરી છે.
૭. મેથીના ઢેબરાં ૦:- બહારગામ જવાનું હોય ત્યારે લોકો સાથે મેથીનાં ઢેબરાં લઈ જય છે. કેટલાક ઢેબરાં સાથે દહીં ખાય છે, ત્યારે તેમને એ ઝ્યાલ નથી હોતો કે ઢેબરાંની અંદર મેથીની ભાજી પડેલી છે. કાચા દહીં સાથે મેથીનો સંયોગ થતાં તેમાં અસંખ્ય જીવો ઉપજે છે માટે મેથીનાં ઢેબરાં ગરમ કર્યા વિનાના કાચાં દહી સાથે ન ખવાય. દોષથી બચવા માટે કઠોળ વગરનાં ઢેબરાં બનાવવાં જોઈએ.

૮. અથાળાં ૦:- શ્રીખંડ આદિના જમણવારમાં લોકો મેથીવાળાં અથાળાનો ઉપયોગ કરતા હોય છે. અથાળાંમાં રહેલી મેથી શ્રીખંડ સાથે ભળવાથી દ્રિવદળ થાય છે. આ દોષના ત્યાગ માટે મેથીવાળું અથાળું ન વાપરવું. મેથીવાળું અથાળું બીજે દિવસે વાસી થાય.
૯. છાશ ૦:- કેટલાક કુટુંબોમાં જમતાં છેલ્લે છાશ પીવાનો રિવાજ છે. ખાસ કરીને કર્છી લોકોને છાશ કે લર્છી વિના ચાલતું નથી. ગુજરાતી ભોજનમાં અથાળાં વિના ન ચાલે, ચાજસ્થાનીને ભોજનમાં પાપડ વિના ન ચાલે, તેવી જ ઠીરતે કર્છીને ભોજનમાં છાશ વિના ચાલે નહિ. કર્છીઓના જહેર સમારંભોમાં પણ છાશ પીરસાય છે. ભોજનમાં દાળ, શાક, ભજ્યા, આદિમાં કઠોળ હોય છે. ભોજન બાદ એંઠા મોંએ અને એંઠા હાથે છાશ-પાન કરાતું હોવાથી કાચી છાશ અને કઠોળનો સંયોગ થવાથી તેમાં બેઈન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. દોષથી બચવાની ભાવનાવાળા પુણ્યાત્માઓ બપોરના ભોજનમાં સારી રીતે ગરમ કરેલી છાશનો ઉપયોગ કરે છે. કાચી છાશ પીધા પછી તે વાસણને કઠોળવાળાં વાસણો સાથે ધોવાય નહિ. કઠોળના એંઠવાડવાળાં વાસણને ધોઈને એ પાણી પી જવું જોઈએ, જેથી દોષ લાગવાનો સંભવ ન રહે. હા, જઠરની ગરમીને કારણે પેટમાં ગયા પછી અંદર કઠોળ ભેગું થાય તો દ્રિવદળનો દોષ લાગતો નથી.
૧૦. કાચું દૂધ ૦:- કાચા દૂધને વાપરવાનો પ્રસંગ બહુ ઓછો આવે છે, તેમ છતાં ઘરમાં દૂધની તપેલી ખુલ્લી રાખવાથી ક્યારેક તેમાં કઠોળનો દાળો પડી જવો કે મેથીની ભાજુનું પાંદડું પડી જવું સંભવિત છે. આ રીતે કાચા દૂધ સાથે કઠોળનો સમાગમ થતાં પણ જીવો ઉત્પન્ન થાય છે. માટે કાચા દૂધને બરાબર ઢાંકીને, સંભાળીને રાખવું જોઈએ.
- દહી માટે જૈનદર્શને કાળ મર્યાદાઓ નક્કી કરેલી છે. દૂધમાં જે દિવસે મેળવણ નાંખ્યા પછી એક રાત વીત્યા પછી જ ખ્યે. બે રાત વીત્યા પછી અભક્ષ્ય બની જાય છે, જીવાકુલ બની જાય છે. માટે દહી મેળવ્યા બાદ ક્યારેય બે રાત પૂરી થવા દેવી નહીં. બે રાત વીત્યા પહેલાં વહેલી સવારે જો દહીને વલોવી નાંખીને છાશ બનાવી લેવામાં આવે તો તે છાશ પુનઃ બીજા બે દિવસ ચાલી શકે છે. એ છાશમાંથી થેપલા બનાવે દેવામાં આવે અને તે થેપલાના ખાખરા બનાવી દેવામાં આવે તો તે ખાખરા ૧૫ દિવસ ચાલી શકે છે. ૧૫ દિવસ પૂરા થતાં

પહેલાં તે ખાખરાઓ ભૂક્કો કરીને વધારાય તો (ચેવડો બનાવાય તો) પાછા ૧૫ દિવસ ચાલી શકે. આમ દહીની બનાવેલી વસ્તુ બદલાતા-બદલાતા ઉદ દિવસ ચાલી શકે છે.

કેટલીક સાવધાની ૦:-

- (એ) દહીં, છાશ, દૂધને અંદરથી બૂડ બૂડ અવાજ આવે ત્યાં સુધી એકદમ કડક રીતે ગરમ કરવા જોઈએ. કેટલીક બહેનો માત્ર તપેલી ગરમ કરીને નીચે ઉતારી દે છે, તે યોગ્ય નથી, આંગળી દાઢે તેવું ગરમ થવા દેવું જોઈએ.
- (બી) દહીં ગરમ કરવાથી કેટલીક બહેનોને ફાટી જવાનો ડર લાગે છે. દહીં ગમે તેવું સારું હોય તો વડા પર પાર્થર્યા પછી તો ફોંદોફોંદા થઈ જતાં હોય છે. તેથી ખોટી ધારણાઓ કાઢી નાંખવી. દહીને ફાટતું અટકાવવા ગરમ કરતી વખતે અંદર સહેજ બાજરીનો લોટ કે મીઠું ભભરાવવાથી ફાટતું નથી.
- (સી) સેવ, ગાંધિયા, ચણાની પુરી, ગુવારફળની તળેલી સીંગો આદિ કઠોળમાંથી બનાવેલી ચીજો ખાતી વખતે ધ્યાન રાખવું કે ચીજ કાચા દહીં, છાશ કે દૂધ સાથે ભળેલી ન હોય.
- (ડી) છાશનો બે રાત્રિ સુધીનો બતાવેલો કાળ વલોણાની છાશનો અથવા સારી રીતે વલોવી બનાવેલી છાશનો સમજવો, જે લોકો પૂરું મંથન કર્યા વિના ઉતાવળે ઉતાવળે દહીં વલોવી નાખે છે તેવી છાશ ન ચાલે. પાણી સાથે દહીનો અંશેઅંશ મળી ગયો હોય એવી છાશ જ ચાલે.

૦: ચલિતરસ ૦:

- (૧) બીજ દિવસમાં જ અભક્ષ્ય બને તેવા રાતવાસી ખાદ્ય પદાર્થો.
- (૨) ૧૫/૨૦/૩૦ દિવસ પછી અભક્ષ્ય બને તેવા ખાદ્ય પદાર્થો.
- (૩) ૪ માસ પછી અભક્ષ્ય બને તેવા ખાદ્ય પદાર્થો.

(૧) બીજે દિવસે અભક્ષ્ય બનના પદાર્થો ૦:- જે પદાર્થોમાં પાણીનો અંશ રહી જવા પામે છે તે બધાં પદાર્થને 'વાસી' કહેવામાં આવે છે. આવા વાસી બનતા તમામ પદાર્થો ત્યાગ કરવા જરૂરી છે. પાણી પોતે એવી તાકાત ધરાવે છે કે એ જે પદાર્થની સાથે ભળે તે પદાર્થને ટૂંક સમયમાં બગાડી નાખે છે. ફર્નિચર ધરમાં રહેશે તો સલામત રહેશે પણ જો તમે એક દિવસ માટે એને બહાર વરસાઈમાં મૂકો તો પાણીથી પલળીને તરત સડવા માંડશે. તે જ

રીતે પાણીવાળા ખાદ્ય પદાર્થો પણ જલદી બગડવા-સડવા માડું છે. તેમાં જીવોત્પત્તિ થવા માડું છે. આવા પદાર્થો નીચે પ્રમાણે છે.

રાતવાસી પદાર્થો

રોટલા, ભજિયા, દૂધપાક, ધારી, શેકેલો પાપડ, રોટલી, વડાં, ખીર, ગુલાબજંબુ, પાણીવાળી ચટણી, લોચાપુરી, ઢોકળાં, મલાઈ, કાચો માવો, શરબતના એસેન્સ, ભાખરી, હાંડવો, બાસુંદી, જલેબી, ચીકુનો હલવો, પુડલા, ઈડલી, ઢોસા, શ્રીખંડ, રસમલાઈ, પૂરણુપોળી, કચોરી, ફુટસલાડ, રસગુલ્લા, સમોસા, દૂધીનો હલવો, બંગાળી મીઠાઈ, પનીર.

(૨) ધણા દિવસો પછી અભક્ષ્ય બનતા પદાર્થો ૦: જૈનર્દર્શન કેટલાક સૂક્ષ્મ ખાદ્ય પદાર્થોની કાળમર્યાદા નક્કી કરેલી છે. જે ખાદ્ય પદાર્થોને શેકીને બનાવવામાં આવે છે, જે ખાદ્ય પદાર્થોને તળીને બનાવવામાં આવે છે, જે ખાદ્ય પદાર્થોનો પાક કરીને રાખવામાં આવે છે, તેવા પદાર્થો દીર્ઘ સમય સુધી પણ સલામત રહી શકે છે. આવા ખાદ્ય પદાર્થોની સમયમર્યાદા શિયાળો, ઉનાળો અને ચોમાસામાં ઋતુના ફેરફારના કારણે જુદી જુદી હોય છે.

(૩) ધણા મહિનાઓ પછી અભક્ષ્ય બનતા પદાર્થો ૦: કેટલાક પદાર્થોનું કુદરતી સ્વરૂપ જ હોય છે કે તે ચાર માસ-આઈ માસ પર્યંત પણ ચાલી શકે છે. કેટલાક પદાર્થોને તૈયાર કરવાની પદ્ધતિ એટલી જોરદાર હોય છે કે તે પદાર્થો પણ લાંબો સમય સુધી ચાલી શકતા હોય છે. દા.ત. વડી, પાપડ, ખીચિયા, અથાણાં વિગેરે.

કેટલીક સાવધાની ૦:

૧. ચુરમાના લાડુ બનાવતા પૂર્વે ચુરમું બનાવવા માટે મુઠિયા બનાવવામાં આવે છે. આ મુઠિયા જો બરાબર તળાયા ન હોય તો અંદર પાણીનો ભેજ રહી જય છે. આવા ભેજવાળા મુઠિયા ભાંગીને કરેલા ચુરમાના લાડું બીજે દિવસે જ અભક્ષ્ય બને છે, માટે ખ્યાલો રાખવો જરૂરી છે.
૨. જલેબી બનાવવા માટે રાત્રે જ આથો નાંખી દેવામાં આવે છે. આ આથો રાતવાસી થતો હોવાથી સવારે તેની બનેલી જલેબી ચાલી ન શકે. તેને બદલે રાત્રે આથો નાખ્યા વિના બનતી અમરતી ચાલી શકે છે. જલેબીનો આથો સવારે નાખે તો જલેબી ચાલી શકે છે, પણ રસોઈયા રાત્રે કામ પતાવી હે છે.

સિઝનલ ટાઈમ લિમિટવાળા પદાર્થો

શેકેલા પદાર્થો

વધારેલા પદાર્થો

તળેલા પદાર્થો

પાકી મીઠાઈ

ચાળા, મમરા, ધાણી,	ચેવડો	સેવ, ગાંઠિયા, ફાક્ડા, મોહનથાળ,	બુંદી
લાડુ,			
દળેલો લોટ, ખાખરા	મમરા	૫૫૫ પુરી વગેરે ફરસાણુંનોલા	ચુરમાના
લાડુ			
			મોતીચૂર વગેરે

કાળ મર્યાદા

(૧)	(૨)	(૩)	(૪)	(૫)
કા.સુ.૧૫ થી ફા.સુદ ૧૪ સુધી જ વપરાય	ફા.સુ.૧૫ થી અ.સુ.૧૪ સુધી	અ.સુ.૧૫ થી કા.સુ.૧૫ સુધી	કા.સુ.૧૫ થી અ.સુ. ૧૪ સુધી આઠ માસ ત્યાજ્ય પદાર્થો ૦:	આદ્રા નક્ષત્રથી તેવા પદાર્થો: વપરાય તેવા પદાર્થો વપરાય તેવા પદાર્થો કેરી, રાયણ, વગેરે ભાજ્યપાલો, કોથમીર, બદામ, ટોપરુ, આખી બદામ, આખું વડી, પાપડ, ખજુર, ખારેક, તલ, ઓસાવેલા તલ, ટોપરું (કાછલીવાળું) ખીચીયાં, સાળેવડાં, ટોપરું, બદામ, કાજુ, ભાજુ, ગુવારકુણી જે દિવસે ફોડાય બીબડાં, સૂક્વાણી ચારોળી, પીસ્તાં, આદિની સુક્વાણી ને તે જ દિવસે દ્રાક્ષ, અખરોટ, (મેવો અ.સુ.૧૪ વાપરી શકાય.
જરદાલુ, આદિ તમામ	પદ્ધી અભક્ષ્ય			
પ્રકારનો સૂક્ષો મેવો.	ગાણ્યો છે.)			

3. દૂધનો માવો પણ બીજે દિવસે વાસી થાય છે માટે બજારનો માવો તો ચાલી જ શકે નહીં. ઘરે બનાવેલ માવો જો બીજા દિવસે રાખવો હોય તો તેને ધીમાં શેકીને લાલ બનાવવો જોઈએ. આવો લાલ માવો અભક્ષ્ય બનતો નથી.
4. માવો કાઢીને બુરું ભેળવીને બનાવવામાં આવતા પેંડા પણ બીજે દિવસે વાસી બને છે. પરંતુ જો દૂધને ફાડીને ચૂલા ઉપર જ ખાંડ ભેળવીને પેંડા બનાવાય તો તે વાસી થતા નથી. તે જ રીતે દૂધને ફાડીને ચૂલા પર જ ખાંડ ભેળવીને બનાવાતી માવાની બરફી બીજે દિવસે વાસી બનતી નથી. દૂધને ફાડ્યા વિના દૂધમાં ખાંડ નાંખીને ચૂલે હલાવતાં હલાવતાં જે પેંડા બનાવાય છે, તે પણ વાસી થતાં નથી.

૫. ગુલાબજંબુમાં માવો વાસી થાય છે અને ચાસણી કાચી પડે છે. માટે બીજે દિવસે રાખી શકતાં નથી. તે જ રીતે રસગુલ્લા, રસમલાઈ આદિ બધી કાચી ચાસણીની બંગાળી મીઠાઈઓ બીજે દિ' અભક્ષ્ય જાણવી.
૬. સુરતની ધારીમાં જે માવો પેક કરવામાં આવે છે, એ જો પહેલાં ધીમાં શેક્યા વિનાનો હોય તો વાસી થાય છે. કેટલાક શ્રાવકો સ્પેશિયલ શેકેલા માવાની ધારી બનાવે છે, તે ચાલી શકે છે. બજારું ધારી અભક્ષ્ય જાણવી. વધુમાં શેકેલા માવાની ધારીનું ઉપરનું પડ ધીમાં સખત રીતે તળાતું નથી. માત્ર ઉકળતા ધીમાં ઝબોળીને કાઢી લેવાય છે માટે ઉપરનું પડ રોટલીની જેમ કાચું રહે છે. માટે તે બીજે દિવસે વાસી થાય. માટે કોઈપણ ધારી બીજે દિવસે વાસી થાય. માટે કોઈપણ ધારી બીજે દિવસે રાખી શકાય નહિ.
૭. ઘણાં લોકો દૂધની મલાઈ રોજ ભેગી કરે છે, પછી તેને તાવીને ધી બનાવે છે. આ પદ્ધતિ યોગ્ય નથી. મલાઈ રાત રહેવા માત્રથી વાસી થાય છે. તેમાં લાળીયા જીવો ઉત્પન્ન થાય છે.
૮. લીલો-સૂકો હલવો લોટ સડાવીને બનાવાય માટે તે અભક્ષ્ય જાણીને છોડી દેવો જોઈએ. ખંભાતનું હલવાસન પણ ત્યાજ્ય ગણાય છે.
૯. આજે શેકેલો ખાખરો ૧૫ દિવસ ચાલે છે, તેમ શેકેલો પાપડ ચાલી શકતો નથી. તેમાં ખાર હોવાના કારણે તે હવામાંથી ભેજ પકડે છે અને બીજે દિવસે જ વાસી બને છે, પણ જો તળીને રાખવામાં આવ્યો હોય તો બીજે દિવસે ચાલી શકે છે.
૧૦. પાંઉ-બિસિક્ટ આદિ પદાર્થોના લોટની, તેમજ તેની બનાવટની કોઈ કાળમર્યાદા જ્યાલમાં હોતી નથી માટે તે અભક્ષ્ય જાણવા. વળી તેના આટાને પણ લાંબો સમય સડાવી રાખવામાં આવે છે. માટે હિંસાનો દોષ પણ લાગે છે. પાંઉ-બિસિક્ટ વગેરે મેંદાના પદાર્થો તો આરોગ્યને હણી નાખવા માટે ટાઈમ-બોંબ જેવું કામ કરે છે. આજના સાયન્સે પણ મેંદાના પદાર્થોને આરોગ્ય માટે ખરાબ નહીં પણ ખતરનાક ગણ્યા છે. દુઃખની વાત છે કે જૈન ધરોમાં ખાખરાની જગ્યા આજે બ્રેડ અને પાંઉએ લીધી છે. આવતીકાલે તેની જગ્યાએ કેલોગ્સ કુ.ના કોન્ફ્લેક્સ અને વીટ્ફ્લેક્સ વગેરે નવા નવા નાસ્તાઓ ગોઠવાઈ રહેવાના છે. ફોરેનનો બધો કયરો ભારતીયોના પેટમાં દટાઈ જવાનો છે. આમ થાય તો જ પરદેશી દવાની કંપનીઓનો વેપલો જોરમાં ચાલે.

૧૧. બરફના ગોળા ઉપર છાંટવામાં આવતા શરબતના એસેન્સ અને કાચી ચાસણીના ભરી રાખવામાં આવતા લીંબુના રસ વગેરે તમામ પદાર્થો અભક્ષ્ય જાણવા.
૧૨. બજરના શ્રીખંડ વગેરે દાદ મહિનાના વાસી હોય છે. તેને તાજ માનીને ખાનારની બુદ્ધિ સાચ્યે જ વાસી થઈ ગઈ હોવી જોઈએ. જત તપાસ વિના વાપરવું યોગ્ય નથી.
૧૩. કેટલાક લોકો દૂધમાં બાંધેલી ભાખરી બીજે દિવસે વાસી નથી થતી એવું માને છે તે ભ્રમણા માત્ર છે. દૂધ વાસી થાય છે તો તેની ભાખરી કેમ વાસી ન થાય ?
૧૪. જો ચટણી બનાવતા પાણી નાખ્યું હોય અથવા ચણાનો લોટ ભેળવ્યો હોય તો તે ચટણી બીજે દિવસે જ અભક્ષ્ય બને છે, પણ જો લીંબુનો રસ નાંખ્યો હોય અને પાણી કે લોટ નાંખ્યા વિના વાટેલી હોય તો તે ત્રણ દિવસ સુધી ચાલે છે. ચટણી બનાવતાં કોથમીર-મરચાં પાણીની ધોયાં હોય તો તે પાણી ચટણીમાં જવાથી ચટણી બીજે દિવસે અભક્ષ્ય બને છે, તેથી પાણીનો અંશ ન રહે તે માટે ઉપયોગ રાખવો જરૂરી છે.
૧૫. ફૂટી ગયેલું દૂધ તથા બેસ્વાટ લાગતી રસોઈ ચલિતરસ ગણાય છે. માટે ઉપયોગ કરવો યોગ્ય નથી.
૧૬. વડી, પાપડ, ખીચીયા વગેરે જ્યારે એકદમ સૂકી હવા હોય ત્યારે શિયાળામાં જ બનાવવા યોગ્ય છે. ચોમાસામાં તેમાં ઉબ (ફૂંગ) લાગવાનો સંભવ છે, માટે ચોમાસા પહેલાં પૂરા કરી દેવા જોઈએ. વડી, પાપડ, ચોમાસામાં અભક્ષ્ય છે એવું શ્રાદ્ધ વિધિમાં જગ્ણાવેલ છે.
૧૭. વિરાધનાનો સંભવ હોવાથી મકાઈના ડોડા, ઘઉના પોખ, જુવારનો પોંખ વગેરે ન વાપરવો.
૧૮. કોરડુ મગ વગેરેના દાળા અચિત છે, પણ અંદરોનિ હોવાથી ચાવવા નહિ. આખા ઉતારી જવા, એમ શ્રાદ્ધવિધિમાં જગ્ણાવેલ છે.
૧૯. ફાગણ ચોમાસી બાદ ટોપરં, બદામ વપરાય છે. ચોમાસા દરમ્યાન આજે ફોડેલી બદામ, કાછલી ફોડીને કાઢેલું ટોપરં (ગોળો ફોડીને કાઢેલું નહિ. કાચલી ફોડીને કાઢેલું ફોકળ ટોપરં જ ચાલે, કેમ કે ટોપરાના ગોળામાં ઊભા ચીરા પડેલા હોય છે. ચીરામાં નિગોટ, કુંથુવા વગેરે પડવાનો સંભવ છે માટે બદામની જેમ ફોડ્યા પછી વપરાય તેમ ટોપરં પણ કાછલી ફોડ્યા પછી વપરાય. આજે ચાલે, બીજે દિવસે રાખવું પડે તેમ

હોય તો તે ધીમાં તળીને રાખે તો ચાલી શકે છે. ટોપરાને તળવા માટે છીણું કરીને તળી શકાય છે.

૨૦. તલ ફ્રાગણ ચૌમાસી પછી અભક્ષ્ય ગણ્યા છે. પણ જો રાખવા પડે તેમ હોય તો તેને ગરમ પાણીમાં ચૂલે ચડાવીને, ઓસાવીને રાખે તો તેમાં જીવ પડતા નથી તેથી આઠ માસ ચાલી શકે છે.
૨૧. કેટલીક કેરીનો પાક આદ્રા નક્ષત્ર પછીથી આવે છે, તેમ છતાં તેને પણ અભક્ષ્ય જ માનવામાં આવે છે. કેરી આદ્રાથી લઈ કારતક પૂનમ સુધી વિશાખા નક્ષત્ર સુધી) બંધ સમજવી.
૨૨. ગુજરાતમાં ફરસાણનો વપરાશ હદ વિનાનો વધી ગયો છે. એક સર્વેક્ષણ પ્રમાણે એક વર્ષમાં એકલું ગુજરાત બે લાખ ૭૨ હજાર મેટ્રીક ટન મીઠું ખાઈ જાય છે. એમાં સૌથી વધારે જથ્થો અમદાવાદી ઓહિયા કરી જાય છે અને સૌથી ઓછો વપરાશ ડાંગ જિલ્લામાં છે. અત્યંત મીઠું ખાવાના કારણે જ ટાલ પડવી, વાળ ધોળા થવાની બીમારી આવે છે. અતિ સર્વત્ર વર્જયેતુ!

કેટલીક સાવધાની ૦:

૧. કેટલાક ઘરોમાં તથા બધી હોટલો અને લારીઓમાં ચહા, શેરડીના રસ વગેરેમાં લીલું આદુંં વપરાય છે. આદુ કંદમૂળ ગણ્યા છે. માટે તેનો ઉપયોગ ન કરવો યોગ્ય ગણ્યા શકાય. તેને બદલે સુંઠથી કામ ચલાવી શકાય છે.
૨. આરોગ્યના નામે કેટલાક લોકો ગાજરનો રસ પીતા હોય છે. તેમણે સમજ રાખવું કે આરોગ્ય એક નહિ પણ તન, મન બે જતનું છે. તનનું આરોગ્ય સુધારવા જતાં જો મનનું આરોગ્ય બગડતું હોય તો એવું જોખમ કરાય નહિ.
૩. કઠોળને લાંબો સમય પલાળવાથી અંકૂરા ફૂટી જાય છે. આવા અંકૂરા ફૂટેલા કઠોળ અનંતકાય ગણ્યા છે માટે તે વપરાય નહિ.
૪. કોઈ એકાદ ચીજની લાલચના કારણે લોકો કંદમૂળની બાધા લેતા અયકાતા હોય છે, તેમણે સમજ રાખવું જોઈએ કે હવા માટે બારી ખુલ્લી રાખવી હોય તો રાખી શકાય પણ આખી રાત બધા બારણાં ઊધાડા રાખીએ તો ગમે તે અંદર ધૂસી જાય. તમારાથી

જે ન ધૂટી શકે તેને બાદ કરીને બાકીના કંદમૂળની પ્રતિશા તો આજે જ ગ્રહણ કરી લેવી જોઈએ.

૫. કેટલાક લોકો ટ્રાવેલિંગના નામે કાયમ માટે કંદમૂળ ખાવાનું ચાલુ રાખે છે. તેમને ભલામણ છે કે બહારગામ ગયા બાદ પણ દૂધ, કેળા, સફ્રજન જેવા પદાર્થો તો બધે મળે જ છે. થોડું ચલાવી લેવાની તૈયારી તો રાખવી જ જોઈએ.

અલ્પબીજ ૦: જે ફૂલોમાં એક બીજ પછી એક પડદો હોય પછી એક બીજ હોય. આ રીતે વચ્ચે આંતરછાલની વ્યવસ્થા હોય અથવા બીજની ઉપર પતલી છાલનું પડ વળેલું હોય તેને બહુબીજ કહેવાતું નથી. દા.ત. કાકડી જેમાં દરેક બીજની વચ્ચે પાતળું પડ હોય છે. શક્કરટેટી-પપૈયું જેનું બીજ ચારેકોરથી પતલાપડથી કોટેડ થયેલું હોય છે.

રીંગણા ત્યાગ ૦: રીંગણા કંદમૂળ નથી તેમ છતાં તે ફ્રિજિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થને બગાડનારા હોવાથી ભગવાને તેના ભક્ષણનો નિષેધ કર્યો છે, રીંગણા ખાનારના શરીરમાં કહુ વધે છે, પિત વધે છે. અવારનવાર તાવ આવ્યા કરે છે અને અંતે જતાં જતાં માણસને ક્ષય થાય છે. આ તો તનની વાત થઈ. મનની વાત લઈએ તો રીંગણા ખાનારનું મન ચંચળ અને તામસી થઈ જાય છે. રીંગણાનો ઓળો કે શાક ખાધા પછી માણસનું મન ચકરાવા લેવા માર્દી છે. ધર્મસંગ્રહમાં કહ્યું છે કે રીંગણા ઊંઘ વધારનાર અને વિકાર પેદા કરનાર છે. શિવપુરાણમાં કહ્યું છે કે હે પાર્વતી ! જે લોકો રીંગણા, મૂળા, કારીગડાં ખાય છે, તે મૂઢ થઈ જાય છે. મરણ સમયે મારું સ્મરણ કરી શકતા નથી.

તુચ્છફળ ત્યાગ ૦: જે ફૂલોમાં કશો માલ નથી તેને તુચ્છફળ ગણવામાં આવે છે. જેમાં ખાવાનું થોડું અને ફેંકવાનું જાણું હોય તેવા બધા ફૂલોને તુચ્છફળ કહેવાય છે. ધણાં ફૂલો ખાવા છતાં પેટમાં સાવ અલ્પ બેલેન્સ થતું હોય એવા ફૂલો ખાવાનો કોઈ મિન્નિંગ નથી. એ રિઝલ્ટ વગરની વ્યર્થ મહેનત કરવા જેવું છે. આવા તુચ્છફળો તૃપ્તિ આપી શકતા નથી. ઉદ્ઘાનો કચરો ખૂબ ફેંકવો પડે છે. એ કચરામાં કિડીઓ, માખીઓ વગેરે જીવજંતુઓ ચીટકે છે. લોકોના પગતળે ચગાઈને મરી જાય છે. આમ ધણી મોટી વિરાધનાઓ થાય છે. માટે ચક્કલીની જેમ આખો દિવસ ચાણવા જેવી આ પ્રવૃત્તિ છોડી દેવી. તુચ્છફળોમાં ૦: ચાણીબોર, તાડફળ, પીચુ, પીયુ, પાકા ગુંડા, આંબલીની મોર વગેરેને તુચ્છફળો જાણવા.

બરક્ક ૦: જૈનદર્શને પાણીના એક બુંદમાં અસંખ્ય જીવોનું અસ્તિત્વ જોયું છે. એકેક જીવને જો સરસવના કણ જેવો બનાવીને છોડવા માંડીએ તો આખો જંબુદ્ધવીપ ભરાઈ જાય.

પણ જલબુંદના જીવો સમાન ન થાય. આવા અસંખ્ય બુંદોનો સરવાળો કરો ત્યારે આઈસ્ક્યુબ બને છે. આ બરફ એટલે વિશાળ જલરાશિ. બરફ વિનાનું સાઢુ પાણી પણ જો ગળ્યા વિના વાપરવામાં આવે તો સાત ગામ બાળ્યા જેટલું પાપ લાગે એવું પુરાળુંથોમાં કહેવાય છે. અળગણ પાણીમાં જો આટલા બધા જીવો હોય છે તો બરફનું તો પૂછવું જ શું ? પાણી જ્યારે જીરો ડિગ્રીએ પહોંચે છે, ત્યારે તે બરફમાં રૂપાંતર થઈ જય છે. આ રીતે રૂપાંતરિત જળમાં અસંખ્ય બેઈન્ટ્રિય જીવો પેદા થઈ જય છે. વિષામાં ખદબદ થતા કીડાની જેમ બરફની અંદર સફેદ અત્યંત જીણા વાળ જેવા અસંખ્ય કીડાઓ પણ ક્યારેક જોઈ શકાય છે. આધુનિક વૈજ્ઞાનિક કેન્ટન જેકોર્સબીએ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી માત્ર એક પાણીના બુંદમાં ઉદ્ઘૃતો હાલતા ચાલતા જીવોને નજરે નિહાળ્યા છે. જો પાણીમાં આટલા હોય તો બરફમાં કેટલા ? જરા સોચો તો ખરા !

અથાળાના પ્રકાર ૦: તડકે બનતા અથાળાં, ચૂલે બનતા અથાળાં, ખાટા રસમાં બનતા અથાળાં.

૧. તડકે બનતા અથાળાં ૦:- કેરી, મરચાં, ગુંડા. વગરેમાં મીઠું ભેળવીને તેને તડકે મૂકવામાં આવે છે. તડકાથી ધીરે ધીરે પાણી સૂક્ષ્માં જય છે. ત્રણવાર, પાંચવાર, સાતવાર, સખત તડકા આપ્યા બાદ જ્યારે સાવ પાણીનો અંશ (એટલે કે વનસ્પતિનો રસ) સુકાઈ જય ત્યારે તે સૂક્ષ્મ બંગડી જેવા બની જય છે. તે પછી તેની પર ગોળ, રાઈ વગરે ચડાવીને સરસવના તેલમાં ગળાબૂડ ડૂબાડીને રાખવામાં આવે છે. આ રીતે બિલકુલ (ડી-હાઇડ્રોટેડ) એકદમ કરું કરીને તેલમાં ડૂબાડેલાં અથાળાં એક વર્ષ પર્યંત ચાલી શકે છે. જો તડકા બરાબર ન અપાયા હોય તો અથાળું કાચું રહી જય છે, એમાં પાણીનો અંશ રહી જય છે. આ પાણીનો અંશ જીવોને પેદા થવા માટે એક મોટું કારણ બની રહે છે. જ્યાં પણ ભેજ રહે છે ત્યાં જીવોત્પત્તિ થયા વિના રહેતી નથી.

ક્યારેક તડકામાં કેરીનો છૂંદો વગરે પણ બનાવાય છે. તેમાં પણ કેરીની છીણમાંથી ખાટું પાણી કાઢી નાંખ્યા બાદ છીણ સાથે મીઠું તથા સાકર ભેળવીને તડકામાં મૂકવામાં આવે છે. જેમ જેમ તડકા અપાતા જય તેમ તેમ ચાસાણી કરક થતી આવે છે. પાણી સૂક્ષ્માં જય છે. જ્યારે ચાસાણી ત્રણ તારવાળી થાય ત્યારે પાકી થઈ સમજવી. (ચાસાણી જોવાની એક રીત છે. ચાસાણીનું એક બિંદુ અંગૂઠા પર મૂકી તેની પર આંગળી દબાવીને ધીરિથી ઊંચી કરવી. આંગળી ઊંચી થતી વેળા જો ચાસાણીમાંથી બે કે અઢી તાર નીકળે

તો તે કાચી સમજવી.. આંગળી ઊંચી કરતાં જો પૂરા ત્રણ તાર ઉપર ખેંચાય તો ચાસકી પાકી સમજવી..)

2. ચૂલે બનતાં અથાણાં ૦:- છુંદો, મુરબ્બો વગેરે કેટલાક અથાણાં ચૂલા પર પણ કરવામાં આવે છે. એમાં પણ પહેલાં ખાંડને ચૂલે ચડાવી તેમાં છુંદાની છીણ કે મુરબ્બાના ટુકડા નાંખીને ચાસણી ત્રણ તારવાળી થાય ત્યાં સુધી હલાવતાં રહેવું પડે છે. ચાસણી પાકી થયા બાદ તેને ચૂલેથી ઉતારી તે હંડુ થઈ ગયા બાદ કાચની બરણીમાં ભરી લેવાય છે. આમાં પણ ચાસણી કાચી રહે તો અથાણામાં જીવોત્પત્તિ થઈ જાય છે.
3. ખાટા રસમાં બનતા અથાણાં ૦:- કેર, મરચાં વગેરેને કાચી કેરીના ખાટા પાણીમાં અથવા લીંબુના રસની ખટાશમાં ત્રણ દિવસ પલાળીને પછી બહાર કાઢીને ફરી ત્રણ દિવસ તડકે સૂકવીને બંગડી જેવા કર્યા બાદ સરસિયાના તેલમાં રાઈ વગેરે ફીણીને પછી કેર કે મરચાંને અંદર હુબાડવામાં આવે છે. આમાં પણ જો પાણીનો અંશ રહી ગયો હોય તો તેમાં તરત જ ઝુગ વળી જાય છે. માટે કાળજ રાખવી જરૂરી બની છે.

કેટલીક સાવધાની ૦:-

1. અથાણાં કાચની બરણીમાં ભરવાં જોઈએ. તેના ઢાંકણો બરાબર ચપોચપ બંધ થવા જોઈએ. બરણીમાં ઢાંકણાં પર ચાર પડવાળું જીણું કપડું બાંધીને ગણેથી દોરી બાંધી પેક કરીને રાખવું જોઈએ. બરણી પેચવાળી હોય તો ય કીડી પેચની ધારે ધારે થઈ અંદર પહોંચી શકે છે.
2. કોઈ પણ અથાણાંમાં મેથીનો ઉપયોગ ન કરવો, કેમ કે મેથીવાળું અથાણું બીજે દિવસે અભક્ષ્ય બને છે. વળી દહીં સાથે અથાણું વાપરતાં દ્રિવદળ થાય છે. એટલે મેથીની જગ્યાએ જરૂર વાપરવાથી કામ ચાલી જાય છે.
3. અથાણાંમાં ગોળ વાપરવો યોગ્ય નથી. ગોળ અને ખટાશ લેગા થવાથી પાણી છૂટે છે તથા માઈલ આલ્કોહોલ બની જાય છે. એમ કેટલીક અનુભવી બહેનોનું કહેવું છે. માટે અથાણામાં ગોળ તેમજ કોઈ પણ પ્રકારનું ધાન્ય કે આટો વાપરવા નહિ.
4. કંદમૂળ, લીલી હળદર, આદુ, ગરમર, ગાજર, લીલાવાંસ, મલબારના મીઠાના પાણીવાળા લીલામરી વગેરે મૂળથી જ અભક્ષ્ય છે. માટે તેનું અથાણું પણ અભક્ષ્ય જાણવું.

૫. ખાટાં ફળોનું અથવા ખાટા રસમાં બનાવેલું અથાણું તડકા દીધા વિનાનું માત્ર ત્રણ દિવસ જ ચાલે છે. તેમાં જો લોટ કે ધાન્ય ભેળવ્યું હોય અથવા પાણી નાંખ્યું હોય તો બીજે દિવસે જ અભક્ષ્ય બને છે.
૬. ગુવારક્ષળીમાં મેથીની ભાજી આદિની સૂક્વાળી કરી હોય તે પણ ચાતુર્માસ પહેલાં જ પતાવી દેવી જોઈએ. બેજ લાગતાં તેમાં પણ જીવોત્પત્તિ થાય છે.

અથાણાંમાં ક્યારે અભક્ષ્યતા-ભક્ષ્યતા ૦:-

(૧) જે ફળમાં ખટાશ છે તે અથવા તેવી વસ્તુમાં ભેળવેલું હોય તે અથાણું ત્રણ દિવસ પછી જ અભક્ષ્ય બને છે. પરંતુ (૨) જો કેરી, લીંબુ વગેરેની સાથે નહિ ભેળવેલા ગુવાર, ગુંદા, કાકડી, ચીભડા, મરચાં વગેરેનાં અથાણાં કે જેમાં ખટાશ નથી તે તો એક રાત્રી વીત્યે બીજે જ દિવસે અભક્ષ્ય થાય. (૩) કેરી કે લીંબુની સાથે આથયું હોય તો ત્રણ દિવસ ખાવામાં બાધ નથી. પણ (૪) જો શેરેલી મેથી નાંખી હોય તો બીજે જ દિવસે વાસી થવાથી અભક્ષ્ય છે, કારાળ કે મેથી ધાન્ય છે. મેથી, ચણાનો લોટ કે દાળિયા નાંખેલ હોય, તો તે દિવસે જ વપરાય. બીજે દિવસે અભક્ષ્ય. (૫) વળી, જે અથાણાંમાં મેથી નાંખી હોય તે કાચાં દૂધ-દહી-છાશ રૂપ ગોરસની સાથે ખવાય નહિ. (૬) કેરી, ગુંદા, ખારેક, મરચાં વગેરેનું સૂક્વેલું અથાણું બનાવે છે તે પણ તડકો બરાબર ન દેવાયા હોય અને લીલાશ રહેવાથી વાળ્યું વળી શકાતું હોય તો તેવું અથાણું પણ ત્રણ દિવસ પછી અભક્ષ્ય થાય.

અથાણાં માટે માત્ર તડકા દેવા તેવું કાંઈ નથી, પણ જ્યાં સુધી કેરી, મરચાં, ગુંદા વગેરે બંગડી જેવાં સૂકાય ત્યાં સુધી પાંચ સાત કે વધારે દિવસ પણ તડકા દેવા જોઈએ. તે મુજબ સુક્વ્યા બાદ રાઈ, ગોળ ચડાવે અને તેલબૂડ હોય, તો તેવું અથાણું વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ફરે નહિ, ત્યાં સુધી ભક્ષ્ય સંભવે છે. પણ તેલ ઓછું હોય તો બગડી જાય ત્યારે ન કલ્પે. બેસવાદ વસ્તુમાં બેઈન્ડિય ત્રસ જીવો ઉત્પન્ન થયેલા હોય છે, તેમાં કુગ વળી જતાં અનંતા જીવો થાય છે, તેવું અથાણું અભક્ષ્ય જાણી ત્યાગ કરવો. બજારના તૈયાર મસાલા લાવીને અથાણાં કરો તો પણ દોષ લાગે જ છે. કેમ કે ગરમ મસાલા વગેરેમાં આઢુ, લસણ વગેરેનો પાવડર મીક્ષ હોય જે ખપે નહીં.

આ પ્રમાણે ઉપયોગપૂર્વક કરેલાં અથાણાં માટે પછી બહુ ઉપયોગ તથા કાળજ રાખવી જરૂરી છે.

ટીનપેક ફૂડ એટલે ? (ઇન્સ્ટન્ટ ઓરાકને બદલે ઇન્સ્ટન્ટ મોટ)

સૌથી કાતિલ જેર ક્રું ? પોટેશિયમ સાયનાઈડ ? બાબિટુરેટ ? આર્સેનિક ? કરતાં વધુમાં વધુ જીવલોણ જેર સી. બોટુલિઝમ નામના સૂક્ષ્મ જીવાણુંઓ પેદા કરે છે. માઈક્રોગ્રામના ફક્ત ૦.૧૨માં ભાગ જેટલું નજીવું જેર મૃત્યુ નીપજાવવા માટે પૂરતું નીવડે છે.

સી. બોટુલિઝમનું આખું નામ તો કલેસ્ટિટિમય બોટુલિઝમ છે, પણ ઉચ્ચાર સરળ બને એ માટે તેના પ્રથમ અક્ષરને ટૂંકાવવામાં આવ્યો છે. આ જીવાણુંઓ વર્ષો થયા ટીન કૂડ ઉદ્ઘોગને પરેશાન કરી રહ્યા છે. સૂપથી માંડીને તૈયાર માછલી સુધીના અનેક ખાદ્ય પદાર્થો હવાચુસ્ત ડબામાં પેક કરવાનો મોટો ઉદ્ઘોગ યુરોપ, અમેરિકી દેશોમાં ચાલે છે. ભારતમાં પણ આ ઉદ્ઘોગ ચાલુ થયો છે. ધાણી ચોક્સાઈ અને ધાણી ચોખ્ખાઈ રાખવા છતાં સી. બોટુલિઝમની જીવલોણ બલા ક્યા ડબામાં પેસી જય તે કહી શકાતું નથી. આજે પણ મોતની તલવાર ટીન કૂડ ખાનાર દરેક વ્યક્તિને માથે તોળાયેલી રહે છે. તલવાર અનેક ઉપર તૂટી પડી છે. છતાં કોના ભાગે આવેલા ડબામાં મોત પુરાયેલું હોય તેની જાણ તો ટીન કૂડ ખાદ્યા પછી જ થાય છે. અને ત્યાર પછી બચવાનો ચાન્સ પણ રહેતો નથી.

સી. બોટુલિઝમ આશ્ર્યર્યજનક માયા છે. આ જીવાણુંઓ ફક્ત ત્રણ કે ચાર માઈક્રોમિટર લાંબા હોય છે. (એક માઈક્રોમિટર એટલે મીટરનો દસ લાખમો ભાગ) ઊંડી જમીનમાં રહેવાને તેઓ ટેવાયેલા છે. બીજા અનેક સજ્જવો માટે પ્રાણવાયુ ખરેખર પ્રાણદાતા છે. જ્યારે સી. બોટુલિઝમને તે માફક આવતો નથી. આ ખાસિયતને લીધે તો કુદરતી સંજોગોમાં ભાંયે જ ખતરારૂપ બને છે. કેમ કે હવાના પુરવઠા વચ્ચે અસ્થિત્વ ટકાવવું તેમના માટે કષ્પરું છે. પરંતુ હવાચુસ્ત ડબામાં સંજોગો કુદરતી હોતા નથી. ખોરાકની જળવણી માટે ઉત્પાદકો તેમાં શૂન્યાવકાશ પેદા કરે છે. એટલે ખોરાકમાં જીવાણુની શરૂઆત થતાં પ્રાણવાયુના અભાવ વચ્ચે તેને ફ્રાવતું મળે છે. જીવાણુની ચયાપચયની કિયા જોર પકડે છે. અને 'બાટુલિનસ' નામના જેરને મુક્ત કરવા માડી છે. ચયાપચયની આડપેદાશ જેવું હળાહળ જેર ખોરાકમાં ભણે છે. ખોરાકનો એ ડબો જે ગ્રાહક ખરીદ્યે તેનું છુટ ટકા તો આવી જ બન્યું સમજવું. પ્રથમ હુમલો પક્ષાધાતનો થાય છે, કેમ કે શરીરમાં દાખલ થયેલું બોટુલિનસ જેર સૌ પહેલાં જ્ઞાનતંતુનો સંચાર બંધ કરી દે છે. ફેફસાંની અને હંદયની ગતિનું નિયમન કરનાર પણ જ્ઞાનતંત્ર છે. એટલે મોત બંને રીતે ટીનકૂડના શોખીને ઘેરી વળે છે.

સી. બોટુલિઝમ ૨૧૨ ફેસનહીટના ઉત્કલનબિંદુએ પણ મરતા નથી. જ્યારે ખોરાકને તેના કરતાં વધુ તાપમાને ગરમ કરી શકાય નહિ. આ જીવાણુને ખતમ કરવા માટે ખોરાકમાં જલદ રસાયણો ભેગવવા મોતને નોતરનારા

બને છે. જૈન દર્શન રેડ સિંગનલ બતાવે છે કે, પાણીના અંશવાળી દરેક વાસી વસ્તુમાં રાત્રિ પસાર થતાં નવા નવા અસંખ્ય ત્રસ જંતુઓ-બેક્ટેરિયા ઉત્પન્ન થતાં રહે છે. જે જેરી જંતુઓનો રસ કૂડને પોઈજન બનાવે છે. જેને ખાનારને ઝાડા-ઉલટી અથવા મૃત્યુ પણ નીપજે છે.

પર્વ-તિથિમાં લીલોતરીનો ત્યાગ શા માટે ?

પ્રાચીન કાળથી ફેલાયેલો આપણો આ જૈન ધર્મ આહાર-વિહારની તથા આચાર-વિચારની પદ્ધતિ માટે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. તેના એક એક સિદ્ધાંત અને આહાર-વિહાર-આચાર-વિચારના પ્રત્યેક નિયમો સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. કારણ કે આ નિયમો કોઈ સામાન્ય મનુષ્ય દૃવારા પ્રયત્નિત કરાયા નથી.

લીલી વનસ્પતિ સજ્વ હોવાના કારણે પર્વતિથિના દિવસે પોતાના માટે થઈને વનસ્પતિના જીવોની હિંસા ના થાય તે માટે પર્વ-તિથિના દિવસોમાં લીલોતરી એટલે કે લીલા શાકભાજીનો ત્યાગ કરવાનો છે.

પર્વતિથિમા લીલોતરીનો ત્યાગ કરવાનું એક અન્ય તાર્કિક અને શાસ્ત્રીય કારણ એ છે કે, લીલોતરીનો ત્યાગ કરવાથી મનુષ્યને લીલોતરીમાં આસક્તિ થતી નથી. સામાન્ય રીતે સૂકા કઠોળ વિગેરે કરતા લીલા શાકભાજી ફળો વગેરેમાં સ્વાદ/મીઠાશ ખૂબ જ હોય છે. માટે મનુષ્યને સૂકા કઠોળ કરતાં લીલા શાકભાજી અને ફળોનો આહાર કરવો ખૂબ જ ગમે છે. જો દરરોજ તેનો આહાર કરવામાં આવે તો તેમાં તેને આસક્તિ ઉત્પન્ન થઈ જય છે, પરિણામે ભવાંતરમાં તેમાં ઉત્પન્ન થવું પડે. કારણ કે કર્મવાદનો નિયમ છે કે જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ.

આયુર્વેદની દૃષ્ટિએ વિચારીએ તો લીલા શાકભાજી પિત્તવર્ધક છે. જ્યારે કઠોળ વાયુકારક છે. તેથી લીલા શાકભાજી વધુ પ્રમાણમાં લેવાય તો પિત્તનો પ્રકોપ થાય છે અને તે ન થાય અને શરીરમાં વાત, પિત અને કફનું પ્રમાણ બરાબર જળવાઈ રહે તે માટે હર ગ્રાણ દિવસે એક વખત લીલા શાકભાજીનો ત્યાગ કરવો અને કઠોળનું સેવન કરવું જોઈએ અને પર્વ તિથિ સંયુક્ત આવે છે તેનું કારણ ફક્ત એટલું જ કે એ પંદર દિવસમા કદાચ પિત થોડું પણ વધી ગયું હોય તો તેનું શમન તે બે દિવસમાં લીલા શાકભાજીનો ત્યાગ કરવાથી થઈ જય છે.

પર્વતિથિએ લીલોતરી ત્યાગના બીજા પણ ઘણાં કારણ છે. લીલોતરી ખૂબ કોમળ હોય છે, અને તિથિના દિવસો કોમળ વસ્તુનો સંહાર એ નિષ્ઠુર પરિણામ લાવે છે. તિથિના દિવસે

પરિણામોનું મદ્દીખીકિશન થાય છે. તો તે દિવસે શુભ અને શુદ્ધ ભાવ રાખ્યા હોય તો તેનો ગુણકાર અને નિષૃત ભાવ થાય તો પુષ્કળ કર્મબંધનું કારણ છે, તેથી તિથિના દિવસે ત્યાગ કરવો હિતાવહ છે.

તિથિના દિવસે ચંદ્રની અસર જલતત્ત્વ પર વધારે હોય છે અને લીલા શાકભાજી વાપરવાથી જલતત્ત્વનો વધુ વધારો થાય છે. જેની અસર સીધી મનના ભાવો પર પડે છે, તેથી તેનો ત્યાગ કરવો ગુણકારી છે.

તિથિના દિવસે ત્યાગ કરવાથી ત્યાગ ધર્મની વૃદ્ધિ થાય છે. તિથિનું મહત્વ જળવાય છે. નાના બાળકોમાં પણ તિથિના સંસ્કાર પડે છે, અને આરાધનાના ભાવો વધે છે.

પરભવના આયુષ્યનો ત્રીજે, નવમે, ૨૭મે ભાગે આયુષ્ય બંધ પડે છે, જેના કારણે પરભવની ગતિ નક્કી થાય છે. અને કોમળ પરિણામ શુભગતિ થવાનું કારણ છે માટે પ્રાય: ૮૨ ત્રીજે દિવસે આવનારી તિથિને લીલોતરી ત્યાગ કરવાથી પરિણામ શુદ્ધ, નિર્મળ બને છે.

રાત્રિભોજન એટલે શું ?

રાત્રિભોજન એટલે સૂર્યાસ્ત પછી અને સવારે સૂર્યોદય પહેલાના સમયમાં ભોજન કરવામાં આવે તે, એમ સામાન્ય રીતે સમજવામાં આવે છે. પરંતુ વિશેષ આરાધકો સૂર્યાસ્તની બે ઘડી પહેલાં આહાર પાણી ત્યાગી હે છે. તથા સવારે સૂર્યોદય પછી બે ઘડી ગયા પછી નવકારશી આદિ કરે છે. રાત્રિભોજનના દોષને જાળુનારો આત્મા સૂર્યોદય અને સૂર્યાસ્તની બે બે ઘડી છોડીને તે પુન્યનું ભોજન કરે છે. અર્થાત પુન્યશાળી બને છે. રાત્રિભોજનના ત્યાગ માટેના પ્રબળ કારણો ૦:-

- ૧) સૂર્યાસ્ત પછી અનેક સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થાય છે કે જે વીજળીના પ્રકાશમાં પણ દેખી શકાતા નથી..
- ૨) રાત્રિમાં સંપાનિક એટલે કે ઉત્તા મરછરાદિ જીવો ભોજનમાં આવી જતા હિંસા થાય છે.
- ૩) રાત્રે જમવાથી ખાદીલો ખોરાક નહિ પચવાથી આરોગ્ય બગડે છે, અજ્જાર્ણ થાય છે, વાસના વધુ જાગે છે, પ્રમાદ-આગસ વધે છે. સવારે ઉઠવાનું મન થતું નથી અને રોગોની હારમાળા સર્જય છે.
- ૪) ઝેરી જંતુની લાળ આવી જાય તો મૃત્યુ નીપજે છે.
- ૫) રાત્રિભોજનના લીધે આયુષ્યનો બંધ પડે તો તિર્યંગતિને નરકગતિનો બંધ થાય છે.

- ૬) ધોર અંધકારથી નેત્રની શક્તિ રહ્યાઈ જવાના કારણે ભોજનની અંદર પડતા જંતુઓને જોઈ શકતા નથી તેથી રાત્રિને વિશે ભોજન સુજ્ઞ મનુષ્ય કરતો નથી.
- ૭) રાત્રિ ભોજન કરનાર મનુષ્યને ધૂવડ, કાગડા, બિલાડી, ગીધ, સાબર, ભૂંડ, સર્પ, વીણી અને ધો વિગેરે તિર્યચ રૂપે ઉત્પન્ન થવું પડે છે. વધુ પરિણામ બગડે તો નરકગતિ સુલભ બને છે.
- ૮) જે મનુષ્યની દિવસની આદિની અને અંતની બે ઘડીઓ મૂકીને ભોજન કરે છે તેને પુન્યનું ભોજન થાય છે.

રાત્રિભોજન છોડવાના કારણો ૦:-

- ૧) રાત્રિભોજન આ ભવને વિષે આરોગ્યની હાનિ કરે છે અને પરભવને વિષે દુર્ગતિ આપે છે.
- ૨) રાત્રિભોજનને સામાન્ય પાપ નહીં પણ મોટું પાપ કહેવામાં આવ્યું છે.
- ૩) રાત્રિભોજનમાં રોગવાળા જંતુ ભોજનમાં આવી જતા કેન્સર વિગેરે રોગો થાય છે.
- ૪) રાત્રિભોજનને લઈને ધાર્મિક કિયા જેવી કે પ્રતિક્રમણાદિ, શુભ ધ્યાનાદિ થઈ શકતા નથી.
- ૫) રાત્રિભોજનથી કેટલીકવાર ઝડપ-ઉલટી અને ગંભીર સ્થિતિમાં અનેક લગ્નાદિ પિકનિક પાર્ટીઓ મુકાઈ ગઈ તેના સમાચાર દૈનિક પત્રો દ્વારા જાળવા મળે છે.
- ૬) સૂર્યની હાજરીમાં વાતાવરણ સ્વર્ચછ રહે છે. જ્યારે અસ્ત થતા વાતાવરણમાં અંધકાર ફેલાઈ જાય છે. ત્યારે પોતાનો આહાર લેવા માટે જીવ જંતુની સૃષ્ટિ આકાશમાં ઉડે છે.
- ૭) આયુર્વેદ શાસ્ત્ર કહે છે કે સૂર્યાસ્ત થાય પછી હૃદયકમળ અને નાભિકમળ સંકોચાઈ જાય છે, એમાં ભોજન કરવાથી આરોગ્યની હાનિ થાય છે. શરીરમાં જડતા પ્રમાદ આવે છે. સૂક્ષ્મ જંતુની હિંસા થાય છે માટે રાત્રિએ ભોજનનો ત્યાગ કરવો સમુચ્ચિત છે.
- ૮) અમેરિકામાં 'સન' નામની સંસ્થા રાત્રિભોજન કરવાનો સખત વિરોધ કરે છે.
- ૯) મહાત્મા ગાંધીજીએ જીવનમાં છેલ્લા ૪૦ વર્ષમાં રાત્રિભોજનનો ત્યાગ દૃઢતા સાથે પાલન કર્યો હતો. તો દરેક જૈનીઓનું કર્તવ્ય છે કે રાત્રિભોજન ન કરવું.
- ૧૦) અજ્ઞાની એવા ચકલી, કબૂતર, કાગડા, પોપટ વિગેરે પણ સૂર્યાસ્ત પછી દાણા ચણુંના નથી. તેઓ પોતે પોતાના માળામાં જતાં રહે છે. તેઓ રાત્રે ઉડતા પણ નથી, તમારા

ધરની અગાસી ઉપર ચણ નાખવામાં આવતી હોય તો તમે પણ જોઈ શકશો કે સૂર્યાદ્ય
થયા પહેલાં કોઈ પક્ષી દાણા ચણવા આવશે નહીં અને સૂર્યાસ્ત થયા બાદ કોઈ પક્ષી
દાણો પણ ચણશે નહીં. કુદરતી રીતે જ પક્ષીઓ રાત્રિભોજનને ત્યાગી દે છે.

- ૧૧) વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે, રાતના જાડ ઐરીલી હવા છોડે છે. જેનાથી આખું
વાતાવરણ અને ભોજન પણ ઐરીલું થઈ જાય છે. આવું ભોજન કરવાથી શરીરમાં
કેટલાય રોગો ઉત્પન્ન થાય છે.
- ૧૨) માર્કન્ડ મુનિએ તો ત્યાં સુધી કદ્યું છે કે, રાત્રે ખાવું તે માંસ બરોબર છે, અને રાત્રે પીવું તે
લોહી પીવા સમાન છે. તેનું કારણ બતાવતા લઘ્યું છે કે, સંધ્યા થવાની સાથે જ
આકાશમાં જથ્થાબંધ સૂક્ષ્મ જીવો ઉડવા માಡે છે. જેમ રાત્રે દીવા સામે અસંખ્ય જીવો
કરતા દેખાય છે, અને ઉધાડા રાખેલ દીવાના પાત્રમાં પડે છે તેમ ભોજનમાં પણ પડે
છે. (આ વાત જૈન ધર્મની સાથે લગતી આવે છે)
- ૧૩) બૌધ્ધ ધર્મમાં પણ રાત્રિભોજનનો નિષેધ છે.
- ૧૪) અમેરિકામાં આજે ૭૦ ટકાથી વધારે લોકો રાત્રિભોજનના નુકસાનોને સમજવાના
કારણે રાત્રિભોજનને પસંદ કરતાં નથી. સૂર્યાસ્ત પહેલાં તે લોકો ભોજન કરવા લાગ્યા
છે. તો આપણા માટે શા માટે અસંભવ થઈ શકે ?
- ૧૫) 'Hialing by water' નામની પુસ્તકમાં ટી હાર્ટલી હુનેસીએ પણ સૂર્યાસ્ત પૂર્વે ભોજન
કરી લેવાનું સમર્થન કર્યું છે. આ રીતે ભગવાન મહાવીર પ્રભુના આદેશને આજના
વૈજ્ઞાનિકોની પણ સંમતિ પ્રાપ્ત થઈ રહી છે.

મધ્યાહ્ન ભોજનની રીત ૦:-

પ્રભુ પૂજા કરીને ઘરે આવ્યા બાદ જમવાનો સમય થાય ત્યારે લાલસા વગર પાચનશક્તિ
પ્રમાણે ભોજન કરવું જોઈએ.

જમતા પહેલાં અને જમ્યા પછી એક અથવા ત્રણ નવકાર મહામંત્રનું સ્મરણ કરવું.
દક્ષિણ દિશામાં મોઢું રાખીને જમવા બેસવું નહિ.

પાંચ તિથિ ૦: સુદ અને વદ પક્ષની બે આઠમ, બે ચૌદશ અને સુદ પક્ષની પાંચમ.
ઓછામાં ઓછી આ પાંચ તિથિએ લીલોતરી શાક, ફુટ-કેળાં વગેરેનો ત્યાગ કરવો.

વિવેક વિલાસ ગ્રંથમાં લખેલ છે કે અકાળે ભોજન કરવું શાસ્ત્ર નિષિદ્ધ છે. વહેલી સવારે , સંધ્યાકાળે, રાત્રે બીજાની નિંદા કરતાં, રસ્તે ચાલતાં, ખુલ્લી જગ્યામાં, તડકામાં-અંધકારમાં કે ઝાડ નીચે બેસીને, તર્જની આંગળી ઊંચી રાખીને ભોજન ન કરવું.

થાળી ધોઈને-નેપકીનથી લૂધીને મૂકવી. ન મૂકવાથી કીડી, મચ્છર, માખી પડે તો હિંસા/વિરાધનાનો દોષ લાગે. અને તેમાં ૪૮ મિનિટ પછી સંમૂર્ચિષ્ઠમ મનુષ્યો ઉત્પન્ન થાય તેની વિરાધનાનો પણ દોષ લાગે.

ભોજન કરતા ત્રણ મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખવાની છે.

૧) એહું મૂકવું નહિ, ૨) એહું ખાવું નહિ. ૩) એઠા મૌંએ બોલવું નહિ.

આપણું એહું ભોજન બીજા કોઈને ખાવા આપવું નહિ. જૈન શાસ્ત્ર અને મનુસમૃતિ વિગેરેમાં નિષેધ કરેલો છે.

સુપાત્ર દાન ૦:- શ્રાવક-શાવિકાએ દરરોજ પંચમહાક્રતધારી સાધુ-સાધ્વીને વહોરાવી સુપાત્ર દાનનો શ્રેષ્ઠ લાભ અવશ્ય લેવો જોઈએ. જો ન મળે તો દિવસ નિષ્ફળ સમજવો.

સાધર્મિક ભક્તિ ૦:- સાધર્મિક ભોજન કરાવીને પછી ભોજન કરવું. જેમ પુણ્યો શ્રાવક હતો. મા-બાપ-અતિથિને ભક્તિથી ભોજન કરાવીને પછી ભોજન કરવું.

અનુકૂંપાદાન ૦:- જમવા અવસરે દીન-દુઃખી ગરીબો તથા અબોલ મુંગા પશુઓને પણ ભૂલી શકાય નહિ. આ બધાંને સાચવવાની જવાબદારી શ્રાવક (ગૃહસ્થી)ની છે. આંગણે આવેલ કોઈને ધૂતકારવો નહિ. બાવા/જોગી/સન્યાસી પણ આંગણે આવી ચડે તો ઔચિત્ય દાન કરવું જોઈએ.

શેરીના કૂતરા ગાયો કબુતર, ચકલા આટિ બધાંને યાદ કરીને ય યથાશક્તિ અર્પણ કરવું.

તિર્થમાં સાવ. ઓછા ચાર્જમાં જમો ત્યારે યથાશક્તિ પહોંચ ફડાવવી જોઈએ. જેથી સામર્થ્યહીન શ્રાવકની ભક્તિનો લાભ મળે. શક્તિ અહોવા છતાં મફતમાં ખાવાનો આગ્રહ ન રખવો.

ગમે તે ખાવું નહિ/ગમે ત્યાં ખાવું નહિ/ ગમે તેટલીવાર ખાવું નહિ. રાત્રે ૧૨ વાગ્યા પછી જો ન ખાંધું હોય તો સવારે નવકારશીનું પચ્ચકખાળું કરી શકાય છે.

રાત્રે ચાર્ચિલારનું પચ્ચકખાળું ન કરી શકાય તેમ હોય તો માત્ર પાણીની છૂટ માટે તિવિહારનું પચ્ચકખાળું કરી શકાય છે. રાત્રિભોજન ત્યાગનો નિયમ પાળવો હોય અને રાત્રે

દવા લેવી પડે તેમ હોય તો દવા માટે દુવિહારનું પરચકખાળું પણ કરી શકાય છે. પાણી કે દવાની ધૂટના નામે આખી જિંદગી રાત્રિભોજન કરવાની લેશ પણ જરૂર નથી.

દવાઓ

વસ્તુનું નામ	વપરાતા પદાર્થો	
પ્રાપ્તિસ્થાન		
૧. ઈસ્ટ્રોજન ઘોડીમાંથી (હોમોન)	દવા અને સૌંદર્ય પ્રસાધનોમાં વપરાય છે.	ગર્ભિણી
૨. કેસ્ટોરિયમ મારીને	દવા અને સૌંદર્ય પ્રસાધનોમાં વપરાય છે.	બીવરને
૩. કસ્તૂરી મેળવવા માટે થી ૩૦૦ મારવા પડે.	દવા, સુગંધીત દ્રવ્યો, સેન્ટ, પાઉડર, કીમ, લોશન, સુગંધી સોપારી, તમાકુ વગેરેમાં ઉપયોગ થઈ શકે.	એક કિલો આશરે ૨૦૦ નરમૃગોને
૪. અંબર	દવા, સુગંધીત દ્રવ્યો, પાઉડર, કીમ, લોશન સુગંધી સોપારી, તમાકુ વગેરેમાં ઉપયોગ થઈ શકે.	હેલ
૫. કેપ્સ્યુલો ચામડાં (દવાઓ ભરવાની)	જિલેટીન	હાડકાં,
૬. કેવિશયમવાળી દવાઓ પ્રાણીજ હોઈ શકે ઇપ		વગેરેમાંથી હાડકાં,
૭. ચિલસરીન ચિલસરીન શકે)	દવા, ટૂથપેસ્ટ, સૌંદર્ય પ્રસાધનો સાબુ બનાવવા વપરાતાં મટન ટેલો અને પ્રાણીજ ચરબીમાંથી પણ હોઈ	(વનરપતિ

૮. ડાયાબિટીસવાળાઓ કંતલ	કરેલા	ઢોર,	બકરાં	વાળાઓ	માટે
પેન્કિયાસમાંથી					
માટે ઈન્સ્યુલિન					
૯. થાઈરોઇડગ્રંથિની	થાઈરોઇડ			કંતલ	કરેલા
જનાવરોની					
બીમારીમાં				થાઈરોઇડ	
ગ્રંથિમાંથી					
૧૦. દમની દવા	એડ્રોનેલિન			કંતલ	કરેલા
ઢોરોની					
ગ્રંથિઓમાંથી					
૧૧. પ્રોટીનવાળી	પ્રાણિજ હોઈ શકે			પ્રાણીઓ	
દવાઓ અને ટોનિક					
૧૨. લીવર	એક્ષેક્ટવાળી દવાઓ			પ્રાણિજ	
પ્રાણીઓના					
જળચરોમાંથી				લીવરમાંથી	
૧૩. વિટામીન એ અને ડી	પ્રાણિજ વહેલા, કોડ, હેલીબટ				
વાળી બનાવટો				વગરે	
જળચરોમાંથી					

પ્રાણી જ ખાદ્ય વસ્તુઓ ૦:-

કોઈ પણ ખાદ્ય વસ્તુ ખરીદતા પહેલાં એમાં વપરાયેલ કાચા માલની વિગત વાંચી સાવધાન બનો. દરેક પેકેટ, બાટલી, ટીનકૂડ લેતા પહેલાં 'તેમાં શું લઘ્યું છે' કેવાં કેવાં રસાયણો, રંગો, ફ્લેવર ઉમેરાયાં છે તેની જાણકારી મેળવી લો.

(૧) નુડલ્સ (સેવ) પેકેટ ૦: જેમાં ચિકન ફ્લેવર (કૂકડીનો રસ) ભેળવવામાં આવે છે. કંઈદા, લસાણમાં ઈડાનું મિશ્રણ થાય છે. નાસ્તાની આઈટમ તરીકે વપરાય છે તે વજ્યે છે. લોટનો કાળ વીતી જવાથી પણ અભક્ષ્ય થાય છે. (૨) ટુથ-પેસ્ટ ૦: લગભગ જેમાં ઈડાનો

રસ, હાડકાનો પાઉડર તથા પ્રાણીજ રિલસરીનનું મિશ્રણ હોય છે. સવારના પહોરમાં દાંત સાહુ કરવા માટે લાગતા હિંસક વસ્તુઓના દોષથી બચવા આયુર્વેદિક નિર્દોષ મંજન વાપરવું સારું. (દા.ત. કાંટાળુ માયુ + ફુલાવેલી ફૂટકડી + બદામના ફોતરાને બાળીને બનાવેલી રાખ)

(૩) ઈન્સ્યુલીન ઈન્જેક્શનોઃ કંઠલ કરેલા ઘેટાં, બકરાં, ભૂંડના પેન્ઝિયાસ નામના અવયવમાંથી બને છે. (૪) કસાટા આઈસ્ક્રીમ ૦ઃ જુદી જુદી કંપનીઓનો આવે છે. તેમાં ઈડાના રસવાળી કેક વપરાય છે. રાસાયણિક દ્રવ્યનું મિશ્રણ થાય છે, આરોગ્યને પણ હાનિકારક છે. (૫) નાહવાના ધાળા ખરા સાબુઓમાં પ્રાણીજ ચરબી આવે છે, જે મટન ટેલોમાંથી બનાવવામાં આવે છે. હિંસક પદાર્થનો ત્યાગ કરી નિર્દોષ ઉપયોગ કરવો. (૬) સૌંદર્ય પ્રસાધનો ૦ઃ લિપસ્ટિક, આઈબ્રો, શેમ્પૂમાં જનાવરોનાં હાડકાનો ભૂકો, લાલ લોહી તેમજ જુદા જુદા અવયવોના રસમાંથી અને ચરબીમાંથી તૈયાર થાય છે. સસલા, વાંદરા, ઉંદર તેમજ જુદા જુદા અવયવોના રસમાંથી અને ચરબીમાંથી તૈયાર થાય છે. સસલા, વાંદરા, ઉંદર પર તે પદાર્થનો પ્રયોગ થાય છે. ધાળા જનવરો મરી જાય છે. કેટલાક અંધ બની જાય છે. હિંસાથી બનેલા સૌંદર્ય પ્રસાધનો ન વાપરવામાં આત્મસૌંદર્ય છે. ચરબી, લોહી તથા માઇલીના શરીરના ભીંગા સૂક્વીને લિપસ્ટિક બનાવાય છે.

- (૧) રેનેટ ૦ઃ ત્રણ દિવસના જન્મેલા વાછરડાનો રસ ચીજ માટેનું મેળવણ છે. ચ્યુર્ટ્ટગગમમાં પણ વપરાય છે.
- (૨) વિટામીન ૦ઃ 'એ', 'ડી'વાળી દવાઓ ફ્રોડોલ, શાર્ક્સ્ફરીલ, કોડલીવર ઓર્ડલ, શાર્ક ઓર્ડલ, પ્રીલર્સ કોડ, પીલર્સ શાર્ક અને હેલીવર નામની વગેરે અનેક દવાઓ માઇલીના લીવર વગેરેમાંથી તૈયાર થાય છે. જેનાથી રીએક્શન આવે છે.
- (૩) સાબુદાળાનો ઈતિહાસ ૦ઃ આંખે દેખ્યા હેવાલ મુજબ સાબુદાળાના કંદને સેમલ બાજુ કલંગ કહે છે. ૫ કિલોનું વજન હોય છે. છાલ કાઢ્યા પછી ખુલ્લામાં ૪-૬ માસ પડી રહેતાં જેમાં ધાળી લાલ-કૂગ થયા કરે છે. પાર વિનાના ત્રસ જીવો ઉપજે છે. અનંતા જીવોની ધોર હિંસા થયા બાદ તેના રસમાંથી સાબુદાળા બને છે. તદુપરાંત પીપરમેન્ટનું ગળપણ, બિસ્કિટ માટેનું ગળપણ, સેલાઈન ઈન્જેક્શન તથા સેલાઈનના બાટલા, ડિટરજનટ પાવડર ગંદા રસમાં પાર વિનાના કીડાઓ ખદ્ખદતાં હોય છે. ધોર હિંસા હોઈ આ ધંધો કરવો નહીં.
- (૪) પીઝા ૦ઃ પીઝામાં ૭ કે વધુ દિવસની વાસી મેંદાની કાચી રોટલી તથા સમોસા માટે મેંદાની વાસી પટૂટીઓમાં અસંખ્ય ત્રસ જંતુઓનો નાશ હોઈ તે અભક્ષ્ય છે.

- (૫) ઈસ્ટ્રોજન ૦: ગર્ભિણી ઘોડીઓના મૂત્રમાંથી મેળવાય છે. એને મેળવવા ઘોડીઓને બાંધેલી દશામાં સતત ગર્ભિણી રાખવામાં આવે છે. કંતલ કરેલાં જનાવરોની ગ્રંથીઓમાંથી પણ મળે છે. દવાઓ અને સૌંદર્યપ્રસાધનોમાં એનો ખૂબ ઉપયોગ થાય છે.
- (૬) ઓલિયેટ્સ ૦: કંતલ કરેલાં જનાવરોમાંથી મેળવાય છે. એનો સૌંદર્યપ્રસાધનોના કિમોમાં ખૂબ ઉપયોગ થાય છે.
- (૭) ઈસીંલાસ ૦: માઇલીમાંથી મળતો જિલેટીન જેવો પદાર્થ, એનો ઉપયોગ સૌંદર્યપ્રસાધનોમાં, જેલી, સરેસ તથા આલ્કોહોલિક પાણી બનાવવામાં થાય છે.
- (૮) કસ્ટર્ડ પાઉડર ૦: કેટલાક કસ્ટર્ડ પાઉડરમાં ઈડા વપરાયાં હોય છે. પુર્ઝિંગ, આઈસ્ક્રીમ, ફૂટસલાડ વગેરેમાં ઉપયોગ કરાયેલો હોઈ શકે.
- (૯) કેસ્ટોરિયમ ૦: પશ્ચિમના દેશોનાં નર બીવર નામના પ્રાણીને મારીને તેની ગ્રંથીઓમાંથી કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ સૌંદર્યપ્રસાધનો અને હોર્મોનની સારવારોમાં થાય છે.
- (૧૦) કોયનિયેલ ૦: મેક્સિકોમાં થતી એક જાતની જીવાતના શરીરની સૂક્વણી કરીને બને છે. આનો ઉપયોગ કેટલાક ખાદ્ય પદાર્થોમાં તથા સૌંદર્યપ્રસાધનોમાં લાલ રંગ તરીકે થાય છે.
- (૧૧) ગિલસરીન-ગ્લોઝસેરોલ ૦: સાબુ બનાવવામાં જો પ્રાણીજ ચરબી વપરાઈ હોય તો તે સાબુની ઉપ-પેદાશ એટલે પ્રાણીજ ગિલસરીન, વનસ્પતિ તેલ વપરાયું હોય તો વનસ્પતિ ગિલસરીન, મોટો ભાગ પ્રાણીજ ગિલસરીનનો હોય છે. તેનો ઉપયોગ દવા, ટૂથપેસ્ટ, ક્રીમ, કાજળ, શેમ્પુ, મલમ, રબર સ્ટેમ્પેડની શાહી, કેટલાક પ્રકારની ટોઝી વગેરેમાં ટકાઉપાણું તથા મુલાયમતા લાવવા માટે થાય છે.
- (૧૨) ચરબી ૦: કંતલ કરેલા કોઈ પણ પ્રકારના જનાવરમાંથી મેળવાય છે. એનો ઉપયોગ બજારની હલકા પ્રકારની મીઠાઈઓમાં, સસ્તા પ્રકારની રાંધેલી વસ્તુઓમાં, સસ્તી ખારી બિસિક્ટ કે આવી બીજી વસ્તુઓને ધી કે તેલની બદલીમાં તળવામાં શુદ્ધ અથવા વનસ્પતિ ધીમાં ભેળસેળ કરવામાં, સાબુમાં તથા ઘણી વાનગીઓમાં બહોળો ઉપયોગ થાય છે.

(૧૩) ચામરી-ચામર ૦: ગાયના વાળમાંથી બને છે. કતલ થયા પછી કાઢે છે, ક્યારેક જીવતા પણ ઉતારાય છે. મંદિરોમાં ઉપયોગ થતો જોવામાં આવે છે.

(૧૪) જિલ્લેટીન ૦: કતલ કરેલાં જાનવરોનાં હાડકાં અને ચામડાંમાંથી મેળવાય છે. તેનો ઉપયોગ જેલી, પુર્દિંગ, આઈસકેન્ડી, કેટલાક પ્રકારની એક્સ્ટ્રા, સ્ટ્રોંગ પિપરમિન્ટ, ચોકલેટો અને ટોફ્ફીઓ, દવાઓ, ચલણી નોટો, અમુક રંગો, છાપવાની શાહી વગેરેમાં થાય છે.

(૧૫) પ્લેસેન્ટા ૦: કતલ કરેલા દુક્કરના પેટનો રસ છે. તેનો ઉપયોગ ચીજ બનાવતી વખતે મેળવણું તરીકે થાય છે.

(૧૬) પેપ્સીન ૦: કતલ કરેલા દુક્કરના પેટનો રસ છે. તેનો ઉપયોગ ચીજ બનાવતી વખતે મેળવણું તરીકે થાય છે.

(૧૭) મટનટેલો અને બીફ્ ટેલો ૦: કતલ કરેલાં ઘેટાં-બકરાંમાંથી મેળવાયું હોય તો મટનટેલો અને ગાય-બળદમાંથી મેળવાયું હોય તો બીફ્ ટેલો કહેવાય છે. તેનો ઉપયોગ બિસ્કિટ અને મીઠાઈઓ બનાવવામાં થાય છે.

(૧૮) મીણ ૦: પાળેલી મધમાખીનું મીણ પ્રમાણમાં ઓછું મળે છે. મીણની વધુ પેદાશ જંગલમાં મધપૂડા તોડીને થાય છે. દરેક મધપૂડો તોડતી વખતે ૧૦ થી ૩૦ હજાર મધમાખી, તેની દીયળ, દીડા વગેરેનો નાશ થાય છે. મધપૂડો નિયોવીને મધ કાઢી લીધા પછી જે વધે તેને તપાવી, ઓગાળી, ગાળીને દરાય તે મીણનો ઉપયોગ મીણબત્તી, બાટિક-કળા, પોલિશ, મોચીનો દોરો, લિપસ્ટિક વગેરે બનાવવામાં થાય છે.

(૧૯) રેનિન-કેરેનટ ૦: જન્મયા પછી બે-ત્રાણ દિવસની અંદર કતલ કરેલા વાઇરડાના પેટનો રસ. એનો ઉપયોગ પેપ્સીનની જેમ ચીજ બનાવતી વખતે મેળવણું તરીકે થાય છે.

(૨૦) લાખ અને શેલક ૦: લાખો ઝીણાં જીવડાં મરે ત્યારે માંડ અડધા કિલો જેટલા તૈયાર થાય છે. તેનો ઉપયોગ જડતરના દાળીના, બ્રશ બનાવવામાં, સીલ તરીકે, રમકડાં, પોલિશ, રંગ, વાર્નિશ, અળતો વગેરેમાં ખૂબ થાય છે.

(૨૧) લાર્ડ ૦: કતલ દુક્કરની ચરબી તેનો સૌંદર્યપ્રસાધનોની કીમોમાં થાય છે.

(૨૨) લેસીથીન ૦: દીડામાંથી મેળવેલું હોઈ શકે. સોયાબિનમાંથી અથવા સિન્થેટિક પણ હોઈ શકે. એનો ઉપયોગ સૌંદર્યપ્રસાધનોમાં તથા પરદેશી ચોકલેટોમાં થાય છે.

- (૨૩) સિવેટ ૦: બિલાડી જેવા સિવેટ નામના નર જનાવરના પેટમાંની ગ્રંથિમાંથી નિયોવીને કઢાતો પદાર્થ સૌંદર્યપ્રસાધનોમાં ચુગંધ માટે વપરાય છે.
- (૨૪) મેન્ટોસ ૦: તેની બનાવટમાં બીફુટેલો (ગાય, બળદની ચરબી) હાડકાંનો પાઉડર, તથા જિલેટીન વપરાય છે. ફૂટેલા ચ્યુંદ્યગગમ વિદ્યાર્થીઓ બહુ જ ખાય છે. આ યુગનાં ઘણાં ઘણાં નજરાણાં છે અને લોભાય છે. અને જાણે અજાણે માંસાહારી બને છે.
- (૨૫) પોલો ૦: સફેદ સ્ટ્રોંગ પીપર છે. જેમાં ગાય-બળદના માંસમાંથી નીકળતા પદાર્થ જિલેટીન અને બીફ ઓરીજન વપરાય છે.
- (૨૬) બટર ૦: માખણ અસંખ્ય ત્રસ જીવોનું મોટામાં મોટું ઉત્પત્તિસ્થાન છે. વલોણાની છાશમાંથી ઉત્પન્ન થયેલું માખણ ૦૦૧૦ કલાકથી વધુ ન રહેવું જોઈએ, તેનું તરત ધી બનાવી નાખવું જોઈએ.
- (૨૭) કાફ્ટ ચીજ ૦: પીજા બનાવવામાં વપરાય છે. ૨ થી ૩ દિવસના જન્મેલા વાઇડ-વાઇડી કપાય છે. કન્ટલખાનામાં ઘણી ગર્ભિણી ગાયો કપાય છે. તેના પેટમાં રહેલાં વાઇડાં, વાઇડી પણ કપાય છે. તેની હોજરીનો રસ એ કાફ્ટ ચીજ છે. માંસાહાર જ ગણાય.
- (૨૮) સ્ટીયરેટ ૦: મટનટેલોમાંથી મળે છે. એનો ઉપયોગ કિમ, લિપસ્ટિક વગેરેમાં થાય છે. કસ્ટર્ડ પાઉડર આઈસ્ક્રીમ, બાસુંદી, ફૂટસલાઇમાં છૂટથી વપરાય છે.
- (૨૯) વિટામીન 'એ', 'ડી' ૦: માઇલીના લિવરમાંથી જ બનાવાય છે. કોડલિવર ઓઈલ, શાર્કઓઈલ, પીલર્સ શાર્ક, હેલીવર પ્રીલર્સકોડ વગેરે ફૂર રીતે મારી નાખેલી માઇલીઓમાં વિટામીન 'એ' 'ડી' મેળવાય છે. એના સેવનથી સ્વભાવ હિંસક-કોધી બને છે. રિએક્શન પણ આવે છે.
- (૩૦) અન્ઝેનાલિન ૦: આ દવા શ્વાસ-દમ માટેની છે. પશુઓના લિવર અને બીજી ગ્રંથિઓમાંથી બને છે.
- (૩૧) સિવેટ ૦: બિલાડી ફૂળનું પ્રાણી છે. અત્તર, સેન્ટ બનાવવા માટે લાખો સિવેટનો નાશ થાય છે. અત્યારે વન્યપ્રાણી જીવન સિવેટને અમૂલ્ય ગણે છે.
- (૩૨) સ્કાટ ઈમલશન ૦: બળદ, બેંસ, પાડાના માંસમાંથી બને છે.
- (૩૩) વીરોલ ૦: ગાયના મગજમાંથી નીકળતો પદાર્થ છે.
- (૩૪) એક્સ્યુરેટ ચીકન ૦: ઉંદરના માંસમાંથી બને છે.

- (૩૫) પેસકેટ પાઉડર ૦: લૂંડ, ડુક્કર, કૂતરાના વૃષણમાંથી બને છે.
- (૩૬) ડેક્સોરેન્જ ૦: કઠલ થયેલા પશુઓની થાઈરોઇડ ગલગ્રંથીમાંથી આ ટોનિક થાય છે અને દવામાં વપરાય છે.
- (૩૭) સ્ટ્રેસકેપ ૦: ગાય, બળદના સૂક્વેલા લિવરમાંથી બનાવાય છે. આ દવાઓ અને આ સૌંદર્યપ્રસાધનો હે ! મારા જ્હાલા ભાઈ-બહેનો-યુવાનવર્ગ, આનો અવશ્ય ત્યાગ કરો. એવો પ્રબળ ત્યાગ કરો કે જીવનમાં કદ્દી પ્રવેશો જ નહીં. હજુ તો આ યાદી ઘણી નાની છે.
- (૩૮) લિપસ્ટિક ૦: મોટે ભાગે પ્રાણીજન્ય છે. યુવતીઓ જે શરીર પર હોશે હોશે લગાડે છે તે ચરબી-લોહી, માછલીના લિંગડા સૂક્વીને બનાવાય છે. અપવાદ પણ છે. તે માટે બ્યૂટી વીધાઉટ કુઅલ્ટી પૂના તરફથી જાળવા પણ મળશે. મારા જ્યાલથી નિર્દોષ સૌંદર્ય પ્રસાધનો અમુક કંપની બનાવે પણ છે.
- (૩૯) બિસ્કિટ બેકરી આઈમો ૦: હવે તો નામી બિસ્કિટ કંપનીઓ એવી કેઈક પણ બનાવી બજારમાં મૂકી છે. જેમાં ઈડા ૧૦૦ % છે એ ન ભૂલશો.
- (૪૦) સુપ. પાઉડર ૦: સુપર ક્યુઝન્ઝ ૦: સુપ બનાવવા જેમાં ચીકન ફ્લેવરનું મિશ્રણ થાય છે. માંસાહાર જ છે. ચીકનફ્લેવર એટલે કૂકડીનું લોહી.

તૈયાર મળતી ન ખાવા લાયક વાનગી અને તેમાં અભક્ષ્ય શું ?

ટામેટાનો સૂપ	૦: માખણ...વાસી..	કાકડીનો સૂપ	૦: કાંદા, પાઉ,
બટર			
જ્હાઈટ વેજટેબલ સૂપ	૦: ગાજર, પાઉ	નાન	૦: મેંદો,
માખણ			
રશિયન સૂપ	૦: ફ્લાવર, માખણ	ચઈનીઝ ફ્લાઇડ રાઈસ	૦: આંજીનો
ગાજર			
ગાજરનો સૂપ	૦: ગાજર, કાંદા	નરગીસ કોક્ટા	૦: ગાજર,
કાંદા			
ગ્રીન ગ્રીનોરી કોક્ટા	૦: પાલક, કાંદા	ચાઈનીઝ બોક્સ	૦: ગાજર,
કાંદા, લસણ			

પાલક મટર પનીર	૦: પનીર, પાલક	સ્વાદિષ્ટ ફૂટ ચાટ	૦: બ્રેડ
રીંગાળાની આમટી આણુ	૦: રીંગાળા, કાંદા	બટાટાની ભાખરવડી	૦: બટાટા,
આલુ મટર પનીર કરી પાલક, બ્રેડ	૦: બટેટા, લસાળ	કેરીની ત્રાણરંગી કટલેસ	૦: બટાટા,
ફાલુદા લસાળ	૦: કન્દેશન મિલ્ક, મેંદો	વેજટેબલ દીવડા	૦: ગાજર,
અમેરિકન ચોપસી વેનિલા, એસેન્સ	૦: નુડલ્સ, આજીનો	કેળાનું પુર્દિંગ	૦: ચોકલેટ,
વેજટેબલ કબાબ ગ્રેબી	૦: આણુ, બ્રેડ	દહી જયફુળ પુલાવ	૦: કાંદા, ચીજ,
ગ્રીન પુલાવ	૦: ફ્લાવર	ચમચમ	૦: પનીર
બ્રેડ પુલાવ	૦: સ્લાઈઝ બ્રેડ	મેંગોરોલ	૦: પનીર
સ્પેનીશ રાઈસ	૦: ચીજ	સ્પેનીસ પુલાવ	૦:
પંજાਬી સમોસા	૦:	મેંદો, કંદમૂળ	ફરાળી સ્વીટ
કેક	૦: બટાટા		
વેજ. કટલેસ બટર, બ્રેડ	૦: મેંદાની પટ્ટટી	ગોડન ટોસ્ટ	૦: બટાટા,
દહી કચોરી/પેટીસ	૦: દિવદળ, બ્રેડ	બ્રેડના ભજિયા	૦: બ્રેડ
મારવાડી કચોરી	૦: બહારની મેંદો પટ્ટટી	સેન્ડવીચ ભજિયાં	૦: બ્રેડ સ્લાઈઝ
મફાઈનો સૂપ	૦: આજીનો મોટો	મોતીવડાં	૦: સાબુદ્ધાળા
વેજટેબલ સૂપ	૦: ફ્લાવર, માખાળ	પાંઉની પેટીસ	૦: પાઉં
આલુબ્રેડ રોલ્સ	૦: બ્રેડ સ્લાઈસ, બટાટા	ફ્લાવર સટું	૦: ફ્લાવર,
કાંદા			
બ્રેડનો ઉપમા	૦: સ્લાઈઝ બ્રેડ	ત્રિરંગી જેલી	૦: જિલેટીન

પૌંચા બોલ	૦: સ્લાઈઝ બ્રેડ	લીલાયણાની કટલેસ	૦: બટાટા
ફેન્કી	૦: ચીજ, બ્રેડ	નવરત્ન કુરમા	૦: પનીર,
ગાજર, બટાટા			
મેક્સિકન ટાકોસ	૦: બેકડ બીન્સ-ટામેટા સોસ		આલુ પાલક
	૦: બટાટા, પાલક		
સ્પેગેટી ઈટાલિયન	૦: ટામેટા સોસ (વાસી)	ચીજ પીજા	૦: ચીજ પીજા
પીજા	૦: મેંદાની વાસી રોટી	વટાળાના કોકૃતા	૦: આદુ, કાંદા
ગાજરનું પુર્દિંગ	૦: ગાજર, બિસ્કિટ	મેક્સિકન બેક વેજટેબલ	૦: ગાજર,
બટાટા			
ટોસ્ટ પેટીસ	૦: બ્રેડ, પનીર	કોબીના સમોસા	૦: આદુ
ફણગાવેલા કઠોળ	૦: અનંતકાય, ફણગા	માવા બટેટા	૦: બટેટા
દહી પેટીસ	૦: હિવદળ	પિંજા બેસ	૦: પીજા
કસાટા આઈસક્રીમ	૦: બ્રાન્ડી, ફસ્ટર્ડ પાવડર	ગાજરની રબડી	૦: ગાજર
પનીર કોકૃતા કરી	૦: પનીર, કાંદા, લસણ	ફરાળી પૂરણપોળી	૦: બટેટા,
સાબુદ્ધાળા			
મોરેયાનો ઉપમા	૦: બટાટા	દાળ-રાજમા માખની કેક	૦: લસણ,
કાંદા, ઈડાનો રસ			
પચરંગી કચુંબર	૦: મૂળા, ગાજર	શાહજહાંની કબાબ	૦: સાબુદ્ધાળા,
બટાટા			
વેજટેબલ ફેન્કી	૦: બટાટા, ગાજર, દુંગળી સનરાઈઝ ક્રેબેઝ		૦: બટાટા,
કાંદા			
આદુનો મુરબ્બો	૦: આદુ	મગની દાળના ચટપટ	૦: પાલખ,
આદુ			
નારંગી કોકૃતા	૦: બ્રેડ	શાકનું ભડથું	૦: કાંદા, લસણ
ટીકી સોસ મસાલા	૦: રતાળુ, કાંદા, પાઉં	સેવ ડબલ રોટી	૦: પાઉં,
લસણ, કાંદા			

વેજટેબલ પેન કેક	૦: કાંદા, આદુ, બટાટા	લીલા શિંગોડાની ખરી	૦: લીલા
શિંગોડા			
ઠાઈ	૦: ખસખસ	સુરણુના વડા	૦: સુરણુ
બટાટાની ચકરી	૦: બટાટા, સાબુદાળા	વેજટેબલ કટલેસ	૦: બટાટા,
ટોસ			
બટાટા પૌંઆ	૦: બટાટા	બ્રેડ સ્ટીફ્સ	૦: બટાટા,
બ્રેડ, કુંગાળી			
સાબુદાળાનો ચેવડો	૦: સાબુદાળા	શાહી કેસર પુરિંગ	૦: પનીર
ગાજર પરોઠા	૦: ગાજર, બટાટા	બ્રેડના કોક્ફન્ટા	૦: બ્રેડ, પનીર
પૌંઆની કચોરી	૦: બટાટા	ચાળાદાળ કોક્ફન્ટા	૦: આદુ, કાંદા,
લસણ			
પનીર રોલ	૦: પનીર	બર્નેસ્ટર	૦: બટાટા,
કાંદા			
કેરીના કોક્ફન્ટા	૦: પનીર	ચીજ કટલેસ	૦: ચીજ,
બટાટા			
બટર પીઝા	૦: બટર, પીઝા	દિલબહાર કોક્ફન્ટા	૦: બટાટા,
ગાજર, બ્રેડ			
પૌંઆની ભેળ	૦: બટાટા	બટાટાના શુલાબજંબુ	૦: બટાટા
ગાજરની ખીર	૦: ગાજર	શક્કરિયાંનો હલવો	૦: શક્કરિયાં
છોલે ભટુરે	૦: કાંદા, બટાટા	મટર પનીર	૦: પનીર, કાંદા
વેજટેબલ પીઝા	૦: ચીજ, કાંદા, પીઝા	ઇટાલિયન પીઝા	૦: પીઝા, કાંદા
ફ્રાણી કટલેટ	૦: રતાળુ, ગાજર, રીગણા, રીગણ ભાત		૦: રીગણા
કરી	૦: પનીર, ગાજર, રીગણા, ગાજરનો સંદેશ		૦: ગાજર
અમૃતી	૦: બટાટા, આરાલોટ	આદુવડાં	૦: આદુ
ચોક્કેનેટ બોલ્સ	૦: વેનિલા, ચેક્લેટ બાર	મસાલા કરી	૦: બટાટા,
કાંદા			

કોઝીતા કરી	૦: બટાટા, કાંદા, લસણ સુરણના વડા	૦: સુરણ
શક્કરિયાંની ખીચડી	૦: શક્કરિયાં વેળુટેબલ કરી પણ	૦: ફ્લાવર,
કાંદા, લસણ		
ગ્રીન પનીર	૦: પનીર, આંદુ હરાભરા કોઝીતા	૦: પાલક,
પનીર, બટાટા		
શિંગોડાનાં દહીવડા	૦: શિંગોડા વેળુટેબલ પીઝા	૦: ચીજ, કાંજ,
		પીઝા
	ટમટમ	૦: બટાટા

આવી અનેક વાનગી હોટેલમાં, લગ્નપ્રસંગોમાં કે ઘરમાં બનાવેલી હોય તો ખાતાં પહેલાં તેમાંથી અભક્ષ્ય વાનગીઓનો ત્યાગ કરવો એ આત્માને અને શરીરને હિતકારી છે.

નોંધ ૦: તુલસી પાન મસાલા બનાવનાર ડી.એસ. ગૃહ પ્રાણીઓના ચામડાની વર્ચ્યે સોનું કે ચાંદી ટીપી વરખ બનાવવાના બદલે મશીનની મદદથી વરખ બનાવે છે. જેનું ભ્રાન્ડ નેઈમ 'ક્રેચ' છે.

ઈતર

ક્રમ વસ્તુનું નામ	વપરાતા પદાર્થો	પ્રાપ્તિ
સ્થાન		
૧. ગુંદર, બુક બાઈન્ડિંગ માટે વપરાતો સરસ, જનાવરોનાં	પ્રાણિજ હોઈ શકે	કઠલ કરેલાં
પોસ્ટ સ્ટેમ્પની પછ્યાડેનું ગુંદર, રેકિન,		હાડકાં.
લાકડાં વગેરેમાં વપરાતો ઱લુ		
૨. ઢોરોને અપાતા ખાણમાં	હાડકાંનો ભૂક્કો	પ્રાણીઓ
૩. મરધા ઉછેર કેન્દ્રોમાં	માઇલીનો ભૂક્કો	માઇલીઓ
મરધાંઓના ખાણમાં		
૪. રાસાયણિક ખાતર	પ્રાણિજ હોઈ શકે	પ્રાણીઓ

સૌંદર્ય પ્રસાધનો ૦: લિપસ્ટિક, આઈબ્રો, શેમ્પૂમાં જનાવરોનાં હાડકાંનો ભૂક્કો, લાલ લોહી તેમજ જુદા જુદા અવયવોના રસમાંથી અને ચરબીમાંથી તૈયાર થાય છે. સસલા, વાંદરા, ટુંદર પર તે પદાર્થોનો પ્રયોગ થાય છે. તેમાં અસંખ્ય જનાવરો મરી જાય છે, અંધ બની જાય છે. મેકઅપમાં શરીરના સુશોભન માટે સ્ત્રીઓ અને પુરુષો તેનો ભરપૂર ઉપયોગ કરે છે, એનો દરેક અહિંસાપ્રેમીઓએ અવશ્ય ત્યાગ કરવો જોઈએ.

* લિપસ્ટિકમાં ચરબી-લોહી તથા માઇલીના શરીરના ભીંગડા સૂક્કવીને ઉપયોગ થાય છે. જેટલીવાર તમારી જ્ઞાન હોઠ ઉપર લાગે તેટલી વાર માંસના આણુઓ પેટમાં જાય છે. દરેક દયાપ્રેમી બહેનોએ ત્યાગ કરવો જોઈએ.

પ્રાણિજ પદાર્થોનો ત્યાગ કરો

૧. જીલેટિન ૦: પ્રાણીઓનાં હાડકાંનો પાવડર છે, જેનો ઉપયોગ જેલી, આઈસ્ક્રીમ, પિપરમેન્ટ, કેપ્સ્યુલ, ચુંગાઈગમ વગેરેમાં થાય છે.
૨. જાજાઝસ ૦: રંગબેરંગી, રબર જેવી નરમ અને સાકર લગાડેલી પીપર તે જીલેટીનના મિશ્રાળુથી નરમ બને છે, જે ખાવા જેવી નથી. દેરાસરમાં નૈવેદ્ય તરીકી ચડાવાય નહીં.
૩. એકસ્ટ્રા સ્ટ્રોંગ સફ્ટેન્ડ પીપરમેન્ટ ૦: જીલેટીનનું મિશ્રાળું, બોન હાડકાના પાવડરનું મિશ્રાળું તેમાં વપરાયું હોય છે.
૪. જેલી કિસ્ટલ ૦: તેમાં જીલેટીન આવે છે.
૫. સેન્ડવીચ સ્પ્રેડ તથા મેયોનીજ ૦: તેમાં ઈડાનો રસ મિક્સ કરાય છે અને બ્રેડ ઉપર લગાડીને ખાવામાં તેનો ઉપયોગ કરાય છે. બ્રેડપાઉંમાં અભક્ષ્ય મેંટો, ધનેરા-ઈયળનો નાશ, આથો લાવતાં ત્રસજીવોનો અનિનમાં નાશ, પાણીના અંશથી વાસી રહેતા કરોડો (લાળિયા/બેક્ટેરિયા) જીવો ઉપને છે. તેથી અભક્ષ્ય અને સચિત છે.
૬. બટર ૦: માખાળુમાં અસંખ્ય ત્રસ જંતુ છે, જે વિકાર અને રોગ કરે છે.
૭. ચાયના ગ્રાસ ૦: જે દરિયાઈ વનસ્પતિ લીલ-શેવાળના મિશ્રાળુથી બને છે.
૮. વાઈન બિસ્કિટ ૦: (નાના-ચપટા ગોળ) તેમાં ઈડાના રસનું મિશ્રાળું હોય છે ૦: તે અભક્ષ્ય છે.
૯. એનીમલ ટાઈપ બિસ્કિટ ૦: (જનાવરોના આકારના) જુદાં જુદાં પશુઓના આકારના જેમ કે ૦: હાથી, ઘોડો, વાંદરો, માઇલું વિગેરે આકારના હોય છે. તે ખાવાથી મેં ઘોડો

ખાધો, સિંહ ખાધો એવા હિંસક સંસ્કારો બાળકમાં પડે છે. માટે ખાવા નહીં અને બાળકોને જગૃતી આપવી.

૧૦. કાફ્ટ ચીજ ૦: રેનેટ ફ્રેમ કાઉઝ (૨-૩ દિવસનાં જન્મેલા વાયરડાંની હોજરીના રસના મિશ્રણથી બને છે. તેનો ઉપયોગ બ્રેડ ઉપર લગાડવામાં તથા પીજા બનાવવામાં થાય છે, માંસાહારનો દોષ લાગે છે.
૧૧. આઈસ્ક્રીમ પાવડર ૦: તેમાં જીલેટીન આવે છે અને તેના મિશ્રણથી આઈસ્ક્રીમ બને છે. (તદુપરાંત જુદા જુદા કેમીકલ-રસાયણના મિણ આઈસ્ક્રીમમાં થાય છે. જે આંતરડાને બગાડે છે, આરોગ્યનો નાશ કરે છે, મંદાળિન કરે છે.
૧૨. ફૂટેલા ચ્યુંદી-ગમ ૦: તેમાં બીજું ટેલો અને હાડકાનો પાવડર છે.
૧૩. મેન્ટોસ ૦: તેની બનાવટમાં બીજું ટેલો, બોન પાવડર તથા જીલેટીન વપરાય છે. ઉપરની (૧૨, ૧૩) બન્ને વસ્તુઓ સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થીઓ પુષ્કળ ખાય છે. મોઢામાં ચંગળે છે. જીભને ચટકો લગાડવા જેવો નથી. તે શાકાહારીને માંસાહારી બનાવે છે.
૧૪. પોલો ૦: સફેદ એક્સ્ટ્રા સ્ટ્રોંગ પીપર જેમાં જીલેટીન એન્ડ બીજું ઓરીજન ગાય-બળદનું માંસ-મિશ્રણ થાય છે. નાના-મોટા ચૂસે છે, અને પેટમાં માંસના આણુનો તામસિક અસર ઊભી કરે છે.
૧૫. પેપ્સીન ૦: સાબુદાણાની વેફર, રતાળું કંદમૂળના રસમાંથી બને છે. જે સડેલા રતાળુના રસના હોજમાં અસંખ્ય કીડાઓ પગ નીચે કચરાયા પછી મશીનમાં ગોળ ગોળ દાણા પડે છે. અનંતકાય અને અસંખ્ય ત્રસ જંતુઓ નાશ હોઈ વજ્યે છે.

સદા પથ્ય - રોજ ખવાય તેવા આહાર ટ્રિબ્યો ૦:

ઘઉં, સાઢી ચોખા (સાઈટ દિવસમાં ઉગાડેલા ચોખા), લાલ ચોખા, મગ, સિંધાલુણ, આંબળા, જવ, અંતરિક્ષ જળ (વરસાદનું ભેગું કરેલું પાણી), ગાયનું ધી, દાડમ, કાળી સૂકી દ્રાક્ષ, જવન્તી (ડોડી)નું શાક, પરવળ, સાકર, હરડે.

રોજ ન ખવાય તેવા પદાર્થો ૦:

દહીં, સિંગાનેલ, બાજરી, ચણા, તુવેર, અડદ, કેળાં (કાચા-પાકા)

આહાર કેવો હોવો જોઈએ ૦:

ઉષણ - ભોજન ગરમ ગરમ હોવું જોઈએ. સિનગં - ભોજનમાં યથોચીત પ્રમાણમાં ધી અથવા તેલ હોવું જોઈએ.

માત્રાવત્ત - માત્રાપૂર્વક ભોજન કરવું.

જીર્ણ - પહેલાંનું ખાયેલું પચી ગયા પછી જ બીજું ભોજન લેવું.

અવિરૂધ વીર્ય - વિરૂધ વીર્યવાળા પદાર્થોનું સેવન ન કરવું.

ઈષટેશ અને ઈષ ઉપકરણ - અનુકૂળ સ્થાન અને મનને અનુકૂળ બધી જ સામગ્રીઓની સાથે ભોજન કરવું.

ભોજન કેવી રીતે કરવું ૦: અતિશીધ્રતાથી ભોજન ન કરવું. અત્યાધિક ધીમી ગતિથી ભોજન ન કરવું. વાતો કર્યા વગર ખાવું. જમતા વખતે હસવું નહિ. ખોરાકમાં મન લગાવીને ખાવું. પોતાની પ્રકૃતિને સમજીને જ ભોજન કરવું. આ ભોજન મારા માટે હિતકારી છે કે નહીં એમ વિચાર કરીને જ ભોજન કરવું.

સાત્વિક વ્યક્તિનો આહાર ૦: આયુષ્ય, ઉત્સાહ, બલ, આરોગ્ય, સુખ અને પ્રિતિ વધારનારા, રસવાળા, સિનગં, સ્થિર, તથા હૃદયને ગમતા ફૂણો ભાવે છે.

રાજસીક વ્યક્તિનો આહાર ૦: અતિ તીખા, અતિ ખારા, અતિ ગરમ, અતિ તીક્ષ્ણ, લુખા, દાહક અને પરિણામે દુઃખ અને શોક કરનારા આહાર ગમે છે.

તામસીક વ્યક્તિનો આહાર ૦: જ્યારે રાંધ્યો હોય ત્યાર પછી એક પ્રહર વીતી ગયા પછીનો જે વાસી ખોરાક હોય, રસ નાશ થઈ ગયો હોય તેવો બગડેલો, દુર્ગંધયુક્ત, વાસી, એંઠો અને અપવિત્ર ખોરાક પસંદ પડે છે.

એટલે જ આપણા આચાર્યો કહે છે કે, જ્યાં સુધી તમે માણસના આહારમાં પરિવર્તન ન લાવો ત્યાં સુધી તમે તેમના વિચાર અને વર્તનને ક્યારેય સુધારી નહીં શકો. આમ આહારથી જ તમે આ જગતને સ્વર્ગ અથવા નર્ક બનાવી શકો છો.

રોન્ઝિંદા દ્રવ્યો ૦: અનાજ

ઘઉં ૦: એક વર્ષ જૂના ઘઉં શ્રેષ્ઠ. તે આપણને વર્ષા, બળ પુષ્ટિ તથા શરીરમાં સ્થિરતા આપે છે, હાડકાંને જોડે છે. જીવન આપનાર તથા પરમ પથ્ય છે માટે ઘઉંની રોટલી, ખાખરા, થૂલી, ભાખરી ખાવી.

ચોખા ૦: વાયુ પિત્તશામક છે. જૂના ચોખા કફ્ફનાશક છે. તેમાં પણ સાંઈઠ દિવસમાં ઉગાડેલા અને લાલ ચોખા શ્રેષ્ઠ છે.

બાજરી ૦: ગરમ ગુખી છે તે બળપ્રદ, કાંતિપદ, અભિનવર્ધક, દીપન, પચવામાં ભારી, વાયુ તથા પિત્તને વધારનાર, મેદનાશક, કબજ્જયાત કરનાર, પુરુત્વનાશક અને સ્ત્રીઓમાં વિષયેચ્છાવર્ધક છે. દરેકને માફક ન આવે. શરદ, ગ્રીઝ અને વર્ષાત્રિતુમાં ખાવી નહીં.

જુવાર ૦: પચવામાં ભારી, શક્તિવર્ધક, રૂચિકર, સ્વાદિષ્ટ, કબજ્જયાત કરનારી, કફ્ફ-પિત અને રૂતદોષનાશક તથા વાયુ કરનારી છે. ધોળી જુવાર બળપ્રદ અને પથ્ય છે તે હરસ, ધા તથા અરૂચીમાં ઉપયોગી છે.

જવ ૦: મળને ઉખેડનાર, ધાને રૂજવનાર, બુદ્ધિ તથા અભિનને વધારનાર, સ્વર, વર્ણ તથા બળ માટે સારા, ખૂબ વાયુ અને મળને કરનાર, ગળાના રોગ, ચામડીના રોગ, કફ્ફ, પિત, મેદ, શરદી, શ્વાસ, ખાંસી, લોહી વિકારને મટાડનાર છે.

સધણા પ્રકારના અનાજ નવાં હોય ત્યાં સુધી પચવામાં ભારી હોય છે. પરંતુ એક વર્ષ પછી અનાજ ધાણાં હલ્કા હિતકારી અને પથ્ય હોય છે.

કઠોળ મગ ૦: આંખોનું તેજ વધારે છે. તાવમાં હિતકારી છે. પરમપથ્ય છે બધા જ કઠોળમાં શ્રેષ્ઠ છે, માટે હંમેશા ખાવા જોઈએ.

ચણા ૦: બળપ્રદ, પ્રમેહ, મેદ, રૂતદોષ, રૂતપિત, કફ્ફ અને પિત ઉપર પથ્ય છે. રોજ ચણા ખાવા નહીં તેમજ જ્યારે ખાવા હોય ત્યારે હિંગ, અજમો, તલતેલ, મીઠું નાંખીને જ ખાવું.

તુવેર ૦: કફ્ફપિતનાશક વાયુકર છે. તે રૂચિકારક, બળપ્રદ પુષ્ટિકારક છે. કબજ્જયાત કરનારી છે. હરસ, રૂતદોષ, કૃમિ અને વિષવાળા માટે હિતકારી છે.

અડદ ૦: પચવામાં ભારી છે, બળપ્રદ, પુષ્ટિકારક છે. તે મૂત્ર, માંસ, મેદ અને વિષયેચ્છાવર્ધક છે. શુકનો સ્ત્રાવ કરનાર છે. બધા કઠોળમાં હીન છે.

વાલ ૦: ધાવણ વધારનાર, કફ્ફનાશક અને વાયુ પિતકારક છે. તે લોહીને બગાડે છે. રૂતપિત દાહ અને આફ્રો કરે છે, મૂત્રવર્ધક છે, શુકનો નાશ કરે છે. જેર તેમજ સોજાને મટાડે છે, વધુ પડતા વાલ ખાવા નહીં.

વધુ પડતા કઠોળ ખાવા નહીં, તેનાથી વાયુ વધે છે. મગ આમાં અપવાદ છે તે રોજ ખાઈ શકાય.

આજે શાકાહાર પ્રત્યેનું વલણ દેશ-વિદેશમાં વધતું જોવામાં આવે છે. કેટલીકવાર તો અતિરેક પણ જોવામાં આવે છે. શાકાહાર કરનારા કેવળ દેખાદેખી કે સ્વાદ ખાતર કે આદત ખાતર ખાતા હોય એવું લાગે છે. તેમાં વિવેક તો ક્યાંય જોવામાં નથી આવતો. પ્રકૃતિ, દેશ, કાળ, વયને જોયા વગર આદેખડ જે રીતે શાકો ખાવામાં આવે છે તેનાથી નુકસાન જ વધારે થાય છે. શાકો પ્રત્યેનો અભિગમ આધુનિક અને પ્રાચીન પદ્ધતિમાં ઘણો જ ફરક જોવામાં આવે છે. ૧૬મી સદીમાં લખાયેલો ગ્રંથ ભાવપ્રકાશ સંહિતામાં શાકોના ગુણ-દોષનું ખૂબ જ વિશાદ વર્ણન કરવામાં આવ્યું છે.

અપથ્ય શાકો શરીરના હાડકાને ચીરી નાખે છે. દૃષ્ટિ હણે છે. શરીરનો વાર્ણ, રક્ત તથા વીર્યનો નાશ કરે છે. સ્મૃતિ અને ગતિને ચોક્કસ હણે છે.

સધણા શાકોમાં રોગ વસે છે અને તે દેહનો વિનાશ કરવામાં કારણભૂત હોય છે. માટે બુદ્ધિશાળી અને સમજુ વ્યક્તિએ તો શાકનો ત્યાગ કરવો.

ઘણું કરીને સર્વ શાકો વિષઠ્ઠભી એટલે કે કબજ્જ્યાત કરનારા, ભારે, રૂક્ષ તેમજ મળ અને આપાનવાયુને પુષ્કળ પેદા કરનારા છે.

શાકભાજુને વાપરતાં પહેલાં ધોવામાં આવે છે, જેને કારણે તેના પર લાગેલા જંતુઓનો નાશ થાય. પણ તાજેતરમાં બ્રિટિશ અખબાર તેઈલી મેલમાં છપાયેલા એક અહેવાલમાં ઈંકોલી નામના બેકટેરિયા શાકને ધોવા છતાં પણ જતા નથી. આવા બેકટેરિયા માંસ અને ઈંડામાં હોય છે. ખાદ્ય પદાર્થોને જ્યારે ધોવામાં આવે છે ત્યારે આ બેકટેરિયા એકબીજાની સાથે ચોંટી જઈ બાયોક્રિલ્મ બનાવે છે. એ આ પડથી તેઓ બચી જાય. છે. પાંડાવાળા શાકભાજુમાં પણ આ જ પ્રક્રિયા થાય છે આ બેકટેરિયાને રેઝિયેશનથી ખતમ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પણ તેની કાંઈ ઝાંઝી અસર થઈ નહીં, કેટલાક રેસાવાળા શાકભાજુમાં તો બેકટેરિયાનું પ્રમાણ વધી ગયું હતું.

આયુર્વેદ અને જૈન શાસ્ત્રો એ પણ એ જ વસ્તુ હજારો વર્ષો પહેલાં કદ્યું હતું. આયુર્વેદાનુસાર વર્ષાઋતુમાં પાણીથી થનારા રોગોની સંભાવના અધિક હોય છે. માટે તે વખતે તળાવ કે નદીનું પાણી ન પીવું. પણ વરસાદનું ઝીલેલું પાણી પીવું, કારણ કે તે સમયે દુષ્પિત પાણી અને શાકભાજુનો સંયોગ થતાં જ કૂમિ કે બેકટેરિયાનું પ્રમાણ પણ વધી શકે છે. જે વિવિધ રોગોત્પત્તિનું કારણ બને છે. જૈન શાસ્ત્રમાં પણ એટલા માટે જ વર્ષાઋતુના ચાર મહિના લીલા શાક ખાવાની મનાઈ કરી છે.

શાક

પરવળ ૦: પચવામાં હલકું હદ્ય માટે હિતકારી, અભિનવર્ધક, સદા પથ્ય, ત્રિદોષનાશક, ખાંસી, લોહીના રોગો, તાવ અને નબળાઈમાં ઉપયોગી છે. આ શાકનો ઉપયોગ અધિક પ્રમાણમાં કરવો. બધા જ શાકોમાં પરવળનું શાક શ્રેષ્ઠ છે.

સરગવો ૦: તે સ્વાદિષ્ટ, કદ્દ તથા પિત્તનો નાશ કરે છે. અભિનવર્ધક છે. તે શૂળ ચામડીના રોગ, અસ્થમા તથા માથામાં ભરાયેલા કદ્દને મટાડેઠે છે.

કારેલા ૦: તે ઠંડા છે, મળને ઉખેડીને બહાર કાઢે છે. પચવામાં હલ્કા છે. તે વાયુને વધારનાર તથા કદ્દ તથા પિત્તનો નાશ કરનાર છે. નાના કારેલા વિશેષ કરીને અભિને વધારે છે.

તૂરિયાં ૦: ઠંડા છે, પચવામાં હલ્કા છે. કદ્દ અને વાયુને વધારનાર અને પિત્તનું શમન કરનાર છે. તે ભૂખ લગાડે છે. તેમજ અસ્થમા, તાવ, ખાંસી અને કૂમિને મટાડે છે.

ભીડા ૦: પચવામાં ભારી છે. રૂચી, બળ અને વીર્યને વધારનાર છે. ખાંસી, મંદાનિન, તથા શરદીમાં સારા નથી. ભાદરવા માસમાં ભીડા ન ખાવા.

ગવાર ૦: પચવામાં ભારે છે. ઠંડા છે, મળ-મૂત્રનું સરણ કરનારા છે. વાયુ તથા કદ્દને વધારે છે, પણ પિત્તનો નાશ કરે છે.

કોબી ૦: તે ઠંડી, મળને ઉખેડનાર, રૂચીકર, પચવામાં ભારી, અભિનદીપક અને હદ્ય માટે સારી હોય છે. તે ધાવણ વધારનાર અને વીર્ય વધારનાર અને વીર્યવર્ધક છે. તે વાયુકારક તથા કદ્દ અને પિત્તનો નાશ કરનાર છે. તે ગ્રભેહ, ચામડીના રોગ, ખાંસી, લોહીના વિકાર અને પિત્તથી થનારા ચક્કરનો નાશ કરે છે. તેની અંદરનો કંદ પચવામાં ભારી હોય છે. કોબીજ કા.સુ. ૧૫થી ફા.સુ. ૧૩ સુધી જ વાપરી શકાય છે.

કાકડી ૦: ઠંડી છે. ઝાડાને બાંધનારી છે. રૂચિકર છે અને પિત્તનો નાશ કરનાર છે. પાકી કાકડી, તરસ, અભિન અને પિત્તને વધારે છે. શરદ ઋતુમાં પાકી કાકડી ન આવી. કાકડીના બીજ મૂત્ર વધારે છે.

ભાજ

જવંતી ૦: પચવામાં હલકી, ઝાડાને બાંધનારી, અભિનવર્ધક, ધાવણને વધારનાર તથા ત્રિદોષશામક અને રસાયન છે. તે કૂમિ, હરસ અને આંખના તમામ રોગોને મટાડે છે. બધી જ

ભાજુમાં જીવંતીની ભાજુ સર્વશ્રેષ્ઠ છે. કા.સુ.૧૫ થી ફા.સુ.૧૩ સુધી જ વાપરી શકાય, પછી અભક્ષ્ય બને છે.

તાંદળજો ૦: ઠંડી છે. મળ-મૂત્રની અટકાયત ને દૂર કરે છે. રૂચીકર અભિનિતીપક તથા કફ્ફ અને પિતને દૂર કરે છે. લોહીના વિકારને દૂર કરે છે. વિષનાશક છે, તથા શ્રમ, દાહ, શીળસ, ખાંસી તથા કબજ્જ્યાતમાં હિતકારી છે. (કા.સુ.૧૫ થી ફા.સુ.૧૩)

મેથી ૦: પચવામાં હલકી છે, વાયુ તથા કફ્ફનાશક છે. પિત વધારનાર અને બળપ્રદ છે. તે ઉલટી, ખાંસી, હરસ કૃમિ તથા ક્ષયમાં હિતકારી છે. તાવ ઉતરી ગયા પછી આપવું ચોમાસામાં ગંદા પાણીમાં પડેલા, સડી ગયેલા, જીવાત લાગેલાં શાકભાજુ ખાવા નહીં.

તેલ

તલનું તેલ ૦: વાયુ તથા કફ્ફનો નાશ કરનાર તથા પિતને વધારનાર છે. તે શરીરને સ્થિરતા, બળ, વર્ણ, વીર્ય, પુષ્ટિ, અભિન તથા બુદ્ધિ વધારનાર છે. સ્થૂળ વ્યક્તિઓને પતલા કરે છે. અને પતલા વ્યક્તિઓને સ્થૂળ કરે છે. કેશવર્ધક, દાંતને મજબૂત કરે છે, સદા પથ્ય છે. ધાને સાફ્ કરે છે, તથા માલિશરૂપે વાપરવાથી ચામડી વાળ તથા નેત્ર માટે હિતકારી છે. મળશુદ્ધિકર છે. ગર્ભારાયનું શુદ્ધિકરણ કરે છે. પ્રમેહ, સ્થૂળતા દુઃખાવા તથા વાયુના રોગોમાં વપરાય છે. બધાં જ તેલોમાં તલનું તેલ જ સર્વશ્રેષ્ઠ છે.

સિંગતેલ ૦: ઝડપાને બાંધનાર, પચવામાં ભારી, ચામડી, આંખ અને દાંતના રોગ કરનાર, ત્રિદોષ પ્રકોપક તથા કબજ્જ્યાત કરનાર છે.

સરસવનું તેલ ૦: અભિનિતીપક, વાયુ તથા કફ્ફને હણનાર તથા પિતને વધારનાર, વીર્યનાશક (વધારે ખાવાથી) તથા ચામડીના રોગો, કાનનો દુઃખાવો, મસા, ધા અને કૃમિનો નાશ કરે છે.

એરંડ તેલ ૦: પચવામાં ભારે, રેચક, ત્રિદોષનાશક, હર્નિયા, પેટના રોગો, મલેરિયા આમવાત, સોજા, મરડો, સંધિવાત, પક્ષાધાત, કમર, પેટ કે પીઠના દુઃખાવાને મટાડે છે. વાયુના રોગોમાં છૂટથી ઉપયોગ કરવો.

કોપરેલ ૦: હદ્દ્ય માટે હિતકારી, કેશવર્ધક, વિષ, દાહ અને અભિનથી દાંજેલા લોકો માટે હિતકારી. વાયુ પિતનાશક છે પણ કફ્ફકાર્ય છે. જુના કોપરાથી સ્વર બગડે છે, વાયુ કોપે છે. ઉનાળામાં માલિશ માટે હિતકારી છે.

ફળો

દ્રાક્ષ ૦: દ્રાક્ષમાં કાળી દ્રાક્ષ સર્વોત્તમ છે. તે વાયુ અને પિતશામક છે અને કદ્દ વધારનાર છે. તે રૂચિકર, બલ્ય, પૌણિક, વર્ણ, નેત્ર અને સ્વર માટે હિતકારી છે. તે શ્રમ, તરસ, દાહ, ખાંસી, તાવ અને ઉલટીને મટાડે છે. કાળી દ્રાક્ષ બાળક, વૃદ્ધ, ગર્ભિણી, સુતિકા તથા રોગીને પણ પથ્ય છે. તે સદા પથ્ય છે. દ્રાક્ષ હંમેશા સૂકી જ વાપરવી.

દાડમ ૦: ત્રિદોષનાશક છે. બળ, પાચન, દૃષ્ટિ, સ્વરવર્ણ, તૃપ્તિ, બુદ્ધિ, શુક અને હદ્ય માટે હિતકારી છે. તે તાવ, તરસ, દાહ, ખાંસી, કૂમિ, અરૂચી અને દુર્ગંધનો નાશ કરે છે.

આંબળા ૦: પચાવામાં હલકા. હદ્ય માટે હિતકારી, પાચક, પુરુષત્વ, બળ અને લોહી માટે સારા છે. આયુષ્યવર્ધક, યુવાની ટકાવનારા, રસાયન અને પરમ પથ્ય છે. હંમેશા આંબળા ખાવાથી નિરોગી યૌવન લાંબા સમય સુધી ટકી રહે છે.

લીંબુ ૦: તે ત્રિદોષશામક, અતિરૂચીકર અને પાચક છે. મંદાળિન, અજ્જાર્ણ, ઉલ્ટી, કંઠરોગ, ક્ષય, શૂળ, કૂમિ, અરૂચી, અતિસાર, દૃષ્ટિદૌર્બલ્ય અને કોલેરાને દૂર કરે છે. ગરમીમાં લીંબુ શરબત લઈ શકાય.

કેરી ૦: પચાવામાં ભારી, ઠંડી અને જડતાકારક છે. વિષયેચણા, અળિન, બળ, પુણિ, તૃપ્તિવર્ધક છે. તરસ અને શ્રમનો નાશ કરે છે. તે મંદાળિન, લોહીનો રોગ, નેત્ર વિકાર, ચામડીના રોગ, પ્રમેહ અને કૂમિના રોગો માટે અહિતકાર છે. આદ્રા નક્ષત્ર પછી ત્યાગ કરવો.

કેળા ૦: પચાવામાં ભારી, ઠંડા અને જડતાકારક છે. તે શુક, બળ, તૃપ્તિ, મંદાળિન, રૂચી તથા કદ્દને વધારે છે. જડાળિનને મંદ કરે છે. સહેલાઈથી પચતા નથી. ચીકણા અને ઠંડા છે. કાચા કેળાં અહિતકર છે. કેળાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.

ઝાંબુ ૦: ઝાડાને બાંધનાર, પાચક, રૂચીકર, પિત અને કદ્દનો નાશ કરનાર, વાયુવર્ધક, દાહ, પ્રમેહ, પથરી માટે હિતકારી છે. સ્વરને બગાડે છે, કબજ્જ્યાત કરે છે, મૂત્ર વધારે છે, વાયુ ખૂબ જ વધારે છે.

જમક્કળ ૦: કબજ્જ્યાત કરનાર વાયુ અને પિતનાશક, કદ્દવર્ધક, શુકવર્ધક અને રૂચિકર છે. આમાં વધારે ગ્રમાણમાં વિરાધના થતી હોવાથી બને ત્યાં સુધી ત્યાગ કરવો.

પપૈયુ ૦: પચાવામાં ભારી, ઝાડાને બાંધનાર, પિતનાશક તથા વાયુ અને કદ્દવર્ધક છે. મંદાળિન, તાવ, શરદીમાં પપૈયું નહીં ખાવું. તે ગરમ નથી. કાચું પપૈયું ખવાય નહીં.

તરબૂચ ૦: પચવામાં ભારે, કબજ્જાત કરનાર, તૃપ્તિ, પુષ્ટિ, બળ તથા મૂત્રને વધારે છે. અજિન મંદ કરે છે અને શુક્ર નાશક છે.

નારંગી ૦: વાયુનાશક, અજિનદીપક, પચવામાં ખૂબ જ ભારી છે. મોસંબીના પણ આ જ ગુણ સમજવા.

ખજુર ૦: વાયુ તથા પિત્તનાશક છે, સ્વાદિષ્ટ છે. ધા, લોહીના વિકાર, મેદ વધારનાર, મૂર્છા, નિર્બળતા, બળતરા અને મગજની નબળાઈનો નાશ કરે છે. (કા.સુ.૧૫ થી ફા.સુ.૧૩ સુધી વપરાય પછી અભક્ષ્ય બને છે.)

ऋતુ પ્રમાણેનો આહાર - (વસ્તુની કાળમર્યાદા અગાઉ જગ્ણાવી છે, તે પ્રમાણે જાણવી.)

હેમંત ઋતુ (માગશર પોષ) - આ ઋતુમાં ગર્જ્યો, ખાટો અને મીઠાવાળો આહાર કરવો. ગરમ, સ્થિનિધ અને પૌષ્ટિક આહાર કરવો. આ ઋતુમાં ખાસ કરીને ધી, દૂધ, દહીં, તલનું તેલ, ગોળ, ઘઉં, તલ, અડદ ખાવું. આ સિવાય ફળોમાં ખજુર, જમરૂખ, બોર, આમળાં, કેળાંં, ટોપરૂ, ટામેટાં બદામ અને કાજુ ખાઈ શકાય. સૂંઠ, તુલસી, કુદ્દીનો, સરગવો લેવાય.

શિશિર ઋતુ ૦: (મહા-ફાગણ) - આ ઋતુમાં હેમંત ઋતુ પ્રમાણે જ આહાર લેવો.

વસંત ઋતુ (ચૈત્ર-વેશાખ) - આ ઋતુમાં તીખ્યો, તૂરો અને કડવા રસવાળો આહાર કરવો. આ ઋતુમાં હળવો, લુખ્યો અને ઓછો આહાર લેવો. આ ઋતુમાં બાજરી, જવ, ઘઉં, મગ, ચણા, તુવેર, ચોખા, સરગવો, સૂંઠ, મરી, મરચાં, દાડમ, આંબળા ખાવા. આ ઋતુમાં શ્રીખંડ, દૂધ, તેલ, ગોળ, અડદ, ખાંડ, મગફળી, શરબત, શેરડી ન ખાવું.

ગ્રીભ્રઋતુ (જેઠ-અષાઢ) ૦: આ ઋતુમાં ગર્જ્યો, તુરો, કડવો, ચીકણો, ઠંડો તથા પ્રવાહી આહાર લેવો. આ ઋતુમાં દૂધ, ધી, સાકર, ઘઉં, મગ, દ્રાક્ષ, આંબળા, દાડમ, કેરી, લીંબુ, શ્રીખંડ, શરબત લેવાય. આ ઋતુમાં દહીં, મીઠું, તલ, ગોળ, અડદ, મરચાં, મરી, ફરસાણ ન લેવાય. આ ઋતુમાં સાકર, વરિયાળી કે તજનું પાણી કે નારિયેળ કે દાડમ કે વાળાનું પાણી પીવું.

વર્ષઋતુ (શ્રાવણ-ભાદ્રવો) - આ ઋતુમાં મીઠાવાળું, ખાટું અને ગર્જ્યું ખાવું. આમાં મુખ્યત્વે હલકો, ઓછો તથા ચીકણો આહાર લેવો. આ ઋતુમાં વધુ પ્રમાણમાં લીલા શાકભાજી, ચણાની બનાવટો, મગફળી, કાકડી, કેળાં, કંદમૂળ કે જંબુ ન ખાવા. આ સિવાય આ ઋતુમાં છાશ, લીંબુ, તલ, તલતેલ, સૂંઠ, સિંધવ, ગોળ અને સૂંઠ ખાવી.

શરદ ઋતુ ૦: (આસો-કારતક) - આ ઋતુમાં મુખ્યત્વે કડવા, ગળા, તુરાં ટ્રવ્યો લેવાં. આમાં ઠંડો, હળવો અને ચીકણો આહાર લેવો. આ ઋતુમાં દૂધ સાકર, ચોખા, ઘઉં, ધી, મગ, કસેલાં દ્રાક્ષ, પરવળ, આંબળા, જવ, શેરડી, તથા ઉકળેલું પાણી ગુણ કરે છે. પરંતુ આ ઋતુમાં દહીં, ભીડા, કાકડી, છાશ, તેલ, લીંબુ, મરચાં, તલ, અડદ હાની કરે છે. આ ઋતુમાં ખટાશ બિલકુલ ન ખાવી.

જમ્યાં પછી મુખ તથા દાંત સાફ કરવા, યોગ્ય મુખવાસ લેવાં, સો ડગલાં જેટલું ચાલવું, ડાબે પડુંથે અધો કલાક આરામ કરવો પાણ સૂર્ય ન જવું. જમ્યાં પછી અધિક વેગથી ચાલવું કે દોડવું નહીં. અધિક શ્રમ કે વધુ બોલવું કે ગાવું નહીં. વાહન ચલાવવાનું નહીં. ખાદ્યા પછી વધુ પાણી ન પીવું.

- રસોઈ કરતી પહેલાં શરીરની તેમજ મનની શુદ્ધિ અવશ્ય કરવી.
- રસોઈમાં વપરાતાં વાસણો શાકભાજી, મસાલા ધોઈને ચોખ્ખા કરવા.
- સવાર અને સાંજની રસોઈ અલગ અલગ બનાવી.
- અનાજ, શાક, ફળો, મસાલાઓ ઋતુ પ્રમાણે જ ખાવા.
- એક વખત ગરમ કરેલો આહાર ફરીથી ગરમ ન કરવો.
- અંધા હાથે રસોઈ ન કરવી.
- વધુ પ્રમાણમાં આહાર રાંધવો નહીં કે તેનો બગાડ કરવો નહીં.
- લોટ બાંધીને મસળવાથી વધુ સ્વાદિષ્ટ બને છે, રસોઈ ફૂટાફૂ બનાવવા સોડા કે અન્ય કાર નાંખવા નહીં.
- કલાઈવાળા વાસણમાં રસોઈ બનાવવી.
- ઘરડાં, બાળકો, યુવાનો, માંદા માણસોનો આહાર અલગ અલગ બનાવવો.
- કોઈ જ જતની કાચી વસ્તુ ખાવી નહીં.
- અથાળાં, મુરજ્જાા, મસાલા, અનાજ વિ. જોઈને જ વાપરવાં.

નં.	દર્શન	વાત પ્રકૃતિ	પિત્ર પ્રકૃતિ	કદ્મ પ્રવૃત્તિ
૧.	દેહાઙૃતિ	અસુંદર, વિચિત્ર કૃશ, દૂબળો, કૂરૂપ	પ્રભાવશાળી, બિહામણી તેજસ્વી ઊંચી	સુંદર, સ્થુલ, સુગઠિત, શિથિલ
૨.	નેત્ર	ઉંડી, ભુખરી, અસુંદર, ચંચલદૃષ્ટિ	માંજરી, પ્રભાવશાળી તેજસ્વી, લાલ, પીળી, તામ્રવાર્ણી	સુંદર, મોટી, આકર્ષક
૩.	ત્વચા	કાળી, લુખી, ફાટેલી, કરમાયેલી, ઉષ્ણપ્રિય, શીતદ્રવેષી	લાલપીળી, તેજસ્વી, શીતપ્રિય, ઉષ્ણદ્રવેષી	સફેદ જડી, સુંવાળી
૪.	જીભ	રૂક્ષ, તરફાયેલી, કાળી સૂક્ષ્માયેલી	લાલ, ગરમ, સ્વરષ્ટ, તામ્રવાર્ણી	ધોળી, પહોળી, સ્નિંધ, જડી
૫.	દાંત	અસુંદર, વિષમ, ઓછા	પીળા, તીક્ષ્ણ, ખવાયેલા	સફેદ, સુંદર, સુવ્યવસ્થિત, મોટા
૬.	કેશા	રૂક્ષ, લુખા ટૂંકા, અવ્યવસ્થિત, ભુખરા	કપિવાર્ણ, પાતળા, અકાળે ધોળા, આછા	કાળા, સ્નિંધ, જડા સુવ્યવસ્થિત, મોટા
૭.	નખ	ખરબચડા, લુખા, વિષમ, ઝાંખા	ચળકના, ગુલાબી, આણીદાર ધોળા, આછા	કાળા, સ્નિંધ, જડા વ્યવસ્થિત, સુંદર
૮.	વર્ણ	કાળો, અરૂણ, ઝાંખો	લાલ, પીળો, તેજસ્વી	ધોળો, ગુલાબી, ગૌર
૯.	વાણી ધીમી, ગંભીર	અપ્રિય, રૂક્ષ, વાચાળ અવ્યવસ્થિત	પ્રભાવશાળી, સ્પષ્ટ તીક્ષ્ણ, ત્વરિત	પ્રિય, સૌમ્ય,
૧૦.	શ્રેષ્ઠ	કૂર	મૃદુ	મધ્યમ
૧૧.	અર્જિન	વિષમ (ક્યારેક ભુખ લાગે, ક્યારેક ન લાગે)	તીક્ષ્ણ (અતિ ભુખ)	મંદ (ઓછી ભુખ)
૧૨.	આહાર	મધુર, અમલ, લવણી, ઉષ્ણ, સ્નિંધ, પ્રિય,	મધુર, તિકન, કષાય, પ્રિય, શીત	કંદુ, મધુર, લધુ, રૂક્ષ, ઉષ્ણ, અદ્યભોજન
૧૩.	નિદ્રા	ઓછી, જાગરૂક	મધ્યમ	વધુ
૧૪.	સ્વસ્થન	વાયવીય, ક્રિયાશીલ કષણજનક	આનેય, સાહસપૂર્ણ, તેજસ્વી, સુવાર્ણ, પલાશ,	જલીય, સૌમ્ય, સુખદ

			અર્થિન, વિવુત, ઉપણ.
૧૫. હાથ-પગ	ફાટેલા, ઊભરેલી શિરા	તલભાગ તામ્રવાર્ણ	ગુલાબી
૧૬. ગતિ	જડપથી ચાલવાવાળો	મધ્યમ	મંદ
૧૭. શોખ	હાસ્ય, વિનોદ, ગાવું,	અધ્યયન, અધ્યાપન, સંશોધન, એશ,	આરામ,
	મનોરેઝન,		
	વગાડવું, કરવું, નાચવું,	સાધના, તપશ્ચર્યા, રમતો રમવી,	ભોજન,
	આભુષણ, સંગ્રહ		
		જુગાર રમવું, ખોટી ચર્ચા સાહસ કરવું, નેતૃત્વ કરવું, તરવું કરવું, વસ્ત્ર કરવી, જાહુના ખેલ	
		બતાવવા	
૧૮. વસ્ત્ર	મેલખાઉં રંગના, ટૂંકા, સોંઘા-સરસના	રંગીન, ભગવા, રેશ્મી,	કિંમતી, ગરમ, સુંદર,
૧૯. સુખ સંપત્તિ	અદ્યપ, રતન, ધન	મધ્યમ	સુખપ્રદ, સર્વે
૨૦. માનસ્થાન	અદ્યપ	વધુ	મધ્યમ
૨૧. આયુષ્ય	અદ્યપ	મધ્યમ	વધુ
૨૨. વજન	અદ્યપ	મધ્યમ	વધુ
૨૩. મનોબળ	અદ્યપ	વધુ	મધ્યમ
૨૪. બળ	અદ્યપ	મધ્યમ	વધુ
૨૫. અવગુણ	અધીરતા, અસ્થિરમૈત્રી, કોધ, આકમણ, દ્રવેષ, હિંસા, આળસ, પ્રમાદ, અવ્યવસ્થા, અસ્થિરતા, કામ, મોહ, લોભ સ્તેન પ્રવૃત્તિ (ચોરી કરવી)		સંકુચિતતા, દીર્ઘદ્રવેષી, દૃઢ વેરી
	ભય, દ્રવેષ, કૃતદનતા, દુઃખીયારાપાણું, શીધારંભ		
૨૬. સ્વભાવ	નિંઘ, તરંગી, કદ્યપનાશીલ કોધી, દયાળુ, નિખાલસ, ઉગ્ર, સૌભ્ય,		આળસુ,
	સ્વાર્થી,		
	લાગણીશીલ, ભૂલકણા, ઉતાવળો, જીદી, પરમાર્થ,		
	ચંચળ, ઉદાર, ગંભીર, દૃઢ,		
	વાત હઠીલો		શીધ્ર પ્રસન્ન, પોતાની
	વિચિત્ર, પ્રલાપ, ગંધર્વચિત્ત,		મનાવવાવાળા, સભામાં

(ગાનપ્રિય), હિંસાશીલ, ખાય, નીડર, આજ્ઞાકારી પર
દંતખાદી (દાંતથી અવાજ પ્રસન્ન અને અનઆજ્ઞાકારી પર
કરવું), દાંતથી નખને કઠોર, દાનશીલ
કોતરવું

૨૭. રોગ વાતજ, વધુપ્રમાણ, પિતજ, ઓછા, ગ્રીષ્મ-શરદ, કદ્જ, મધ્યમ,
વર્ષા-શિશિર મુખરોગ વસંત-હેમંત

૨૮. દ્રાક્ષાંત

એતિહાસિક નારદ, શકુની	દુર્વાસા, રાવણ, શિવાજી	સરસવતી, વરૂણ,
પક્ષી કાગડો, બગલો, ગીધ સમડી, પોપટ, ધૂવડ		હંસ, મોર, કબુતરે
પશુ બકરૂ, ઊંટ, શિયાળ, વાધ, વરૂ, રોછ, બિલાડુ, ગવેદું, સસલું, કાંગારૂ, કૂતરો		હાથી, ભેંસ, બળદ, વાંદરો, નોળીયો ભૂડ,
ઘડું		
જવજંતુ ઉંદર, મરછર, દેઢકો	ભમરી, વીંઠી, કાનખજૂરો, ઈયળ સાય	
૨૯. ઉમર વૃદ્ધ	યુવાન	બાળક
૩૦. મિત્ર અદ્ય	મધ્યમ	અધિક
૩૧. બુદ્ધિ અનવરિથત	નિપુણ, ચાલાક	સમૃતિવાન, મેધાવી